

॥ तस्य वाचकः प्रणवः ॥

# લતસરા

આત્મનો હિતાય જગતઃ સુખાય



‘योग’ भिक्षा लावीओ, ‘भिक्षु’ बनी ગુડુદાર;  
મુમુક્ષુ જરૂર પામશે, સૌનો મુજમાં ભાગ.

॥ ૩૦ ॥

॥ તસ્ય વાચકઃ પ્રાગુવઃ ॥

### ઓમુપરિવારના ઉત્સવ - ૧૯૮૮

ક્ષા પ્રસંગ નિમિત્તે	સ્થળ	તારીખ અને વાર
ગુરુપૂર્ણિમા	ઠંચાબેનની વાડી, પુષ્પકુંજ પાસે કાંકીયા, માણીનગર, અમદાવાદ-૨૮.	૮-૭-૮૮ ગુરુવાર સવારે ૭ થી ૩
ઓમ ગુરુદેવ જયતી	પંકજલાઈ શાહ અથોક ઓપાઈમેન્ટ, સેન્ટ્રલ બેંકની સામેના ગલીમાં, સી. એન. વિદ્યાલય પાસે, ગાંબાવાડી, અમદાવાદ.	૧૪-૧૦-૮૮ બુધવાર સાંને ૪ થી ૮
નેતૃત્વ વર્ષ	નેપથલાઈ વાસ ૩, ગંગાધર સોસાયટી, સરદાર પટેલ હાઈસ્કૂલની સામે, માણીનગર, અમદાવાદ -૮.	૨૧-૧૦-૮૮ બુધવાર સવારે ૭ થી ૮
શ્રી ગાયત્રી અનુષ્ઠાન સાધના શિબિર નિમિત્તે	"નિર્વિકલ્પ મુક્તિપામ"	૨૭-૧૨-૮૮
	નાથાભાઈ એ. પટેલના જેતરમા, મુ. પલિયડ (વેડા), તા. કલોલ, નિ. મહેસાગુા.	રવિવાર સવારે ૧૦ થી ૩

નોંધ : ઓમુભગવાનની દૃપાથી, આધ્યાત્મિક સ્મૃતિની જગૃતિ અને આધ્યાત્મિક સંગ્રહનની ભાવનાથી ઉત્સવ મનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો ઉત્સવ વિષેની વિગત ઉત્સવના આડ-દસ દિવસ પહેલાં મેળવી લેવી જરૂરી છે. અમદાવાદની બહાર ઊજવાતા ઉત્સવોના સ્થળો પહોંચવા માટે લક્જરી કે એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવે છે. તો જે તે કાર્યક્રમ માટે નક્ષી ધેલ સમય પહેલાં પૈસા ભરી નામ નોંધાવી દેંતું જરૂરી છે.

ઉત્સવની તારીખ અને સ્થળ યાદ કરવા માટે આ પત્રિકાની સાચવણી જરૂરી છે.

શ્રી ગાયત્રી અનુષ્ઠાન સાધના શિબિર નિમિત્તેનો ઓમકાર ધ્વજ રોહણ તથા બિહૂબોધોન્સવ  
તા. ૨૮-૧૨-૮૭ - રવિવાર

સ્થળ :- નિર્વિકલ્પ મુક્તિપામ. (નાથાભાઈ એ. પટેલના જેતરમાં)  
મુ. પલિયડ (વેડા), તા. કલોલ, નિ. મહેસાગુા.

## અતિમલરા

**(અતિમલરા એટલે અનુભવયુક્ત સત્યથી ભરેલું)**  
**(બહુજનહિતાચ - બહુજનસુખાચ)**  
**જાન્યુઆરી - ફેબ્રુઆરી - માર્ચ (ત્રિમાસિક)**

VOL - VII ( 97-98 )

ISSUE - III

માનદ તત્ત્વી - નેષધ વાસ

### પ. પૂ. ગુરુદેવ શ્રી યોગભિક્ષુજીની જીવનગાથા

- યોગભિક્ષુ

સંકલન : નેષધ વાસ

#### બચપણનાં સંભારાળાં

(૧) અમારા કુટુંબમાં પહેલેથી જ એવો રિવાજ અને અમારાં બાનો ખૂબ આગ્રહ કે ધરમાં ધારાગું બાળક હોય એને સવારમાં ઉઠતાવેંત હરરે અને શેકેલા કાચકાનો ઘસરકો પિવડાવવાનો. એના કારણે બાળકની તંદુરસ્તી ખૂબ સારી રહેતી. અમે બધા જ બાઈબલેનો બચપણમાં ખૂબ તંદુરસ્ત અને નિરોગી. આમ, બાળકને બચપણમાં સોઈપણ પ્રકારની તકલીફ નહે જ નહીં. બહેનો મોટી થઈ, પરાળીને પોતપોતાના સાસરે ગઈ ત્યારે આ સંસ્કાર સાથે જ લઈને ગઈ. બહેનો પણ પોતાના બાળકોને હરરે અને કાચકાનો ઘસરકો પિવડાવે. તેથી તેમનાં બાળકો પણ ખૂબ તંદુરસ્ત રહેલાં. વેદકીય રીતે વિચારતાં પાણ આ પ્રયોગ ગોળ્ય લાગે છે. કારણ કે ધારાગું બાળક સામાન્ય રીતે દૂધ ઉપર જ હોય; ચાહે માતાનું, તે ચાહે જાણનું, તે ચાહે બક્કરીનું દૂધ. દૂધનો સ્વભાવ વાયુ અને કૂમિ પેદા કરવાનો. તેથી આ બંને તકલીફી ઉપર હરરે અને કાચકું (કડવાશ) ખૂબ અસરકારક કરેવાય. હરરે વાયુ ઉપર અસર કરે અને કડવાશ કૂમિ ઉપર અસર કરે. એટલે એ પિવડાવવાથી બાળકના પેટમાં કરમિયાં અને વાયુ થાપ જ નહીં. તો, પહેલેથી જ ધરમાં અને પિવરમાંથી આ સંસ્કાર લઈને ગયેલી બહેનોના સાસરે આ રીતે જ બાળજીઓ થતો.

નાના બાળકને ખોળામાં લઈ અમારાં બા બેઠાં હોય. સામે નાનો ઓરસિયો હોય. (એ ઓરસિયો અત્યારે પણ અમારી

પાસે છે.) બા એ ઓરસિયા ઉપર દૂધકે પાળીના બે-ત્રાણ ટીપાં નાખી, બેઠાં બેઠાં કાચકું ઘસતાં હોય. એ થોડું ઘસાય એટલે આંગળી દારા ચમચાના કંઢા ઉપર લઈ લે. પણી હરરે ઘસે. હરરેને પણ આંગળી દારા ચમચા ઉપર લઈ લે. આ કિયા ચાલતી હોય ત્યારે અમે બધાં બાળકો બાની ફરતે ટોળું વળને બેસી જાંય હોઈએ; બે હથેળીઓ, આગળ જમીન ઉપર ટેક્વા દીઘેલી હોય અને ધ્યાનપૂર્વક જાગો કોઈ રમત નિહાળતાં હોઈએ એમ એ કિયા જેતાં હોઈએ. બા બાળકને ઘસરકો પિવડાવવા જાય ત્યારે બાળક મોઢું ખોલે નહીં. બા એક આંગળી એના મોઢામાં નાખી, એનું મોઢું પહોળું કરી ઘસરકો પિવડાવી હે. ઘડીક વાર તો બાળક ગળગળ, ગળગળ, ગળગળ એવો ગળામાંથી અવાજ કાઢે અને ઘસરકાને મોઢામાં જ રાખે, પેટમાં ઉતારે નહીં. થોડી વાર પણી ઘસરકો જાંક દઈને બાળકના પેટમાં ઊતરી જાય. અમે સી બાળકો નવિનતા અને મનોરંજનની દાખિયો આ કિયા જોતા હોઈએ. આ દશ્યની સાથે સાથે અમારી નજર બાની બાનુમાં પેલા ઘસાયેલા કાચકા ઉપર હોય. મોક્કો મળતાં અમે જપટ મારી, કાચકું લઈને બાળી જઈએ. બધા 'ભાગ્યો... ભાગ્યો...' કરતા રહે એ દરમાન થોડા આગળ જઈ અમે કાચકાને મોઢામાં નાખી કરીને ખાઈ જઈએ. કાચકું કડવું એર નેંબું, માથાના વાળ ઊભા કરી નાખે એવું. તો, એવા કાચકાને અમે નાના હતા ત્યારે કરીને ખાઈ જતા.

એવા પ્રકારનો અમારો સ્વભાવ, એવા પ્રકારની કુદરતી બજિશ.

આ વાત એટલા માટે યાદ આવી કે અત્યારે અમે સિંગેરની આસપાસ પહોંચી ગયા. હવે ઉમર પ્રમાણે, જમાના પ્રમાણે, મોસમ પ્રમાણે નેમ બધા બીમાર પડે એમ અમે પણ બીમાર પડીએ અને વત્તાઓછા પ્રમાણમાં દવાઓથી કરવી પડે. નેમ સૌ ગોળીને મોઢામાં નાખી, ઉપર પાણીનો ધૂંઠો લઈને ગોળી ગળી જાય તેમ અમે દવાની ગોળીઓને પાણી સાથે ગળી શકતા નથી. અમારા માટે આ રીતે ગોળી ગળવાનું કામ મહામુશ્કેલીનું. અને જે એ રીતે ગળવા જઈએ તો ગોળી અન્નનળીમાં ફસાઈ જાય. આવા અનુભવો પાંચ-સતત વખત થયા અને એ વખતે બહુ ત્રાસ થથો. પાંચ સુધી ગોળી ઉત્તરવાની રાહ જોવી પડે અને ઘણ્ણા સમય પછી એ ગોળી એની મેળાએ જ નીચે જિતેર. ત્યાં સુધી મહા ત્રાસ વેઠવો પડે. આવા અનુભવો પછી અમે એવું નક્કી કર્યું કે ગોળીને ખાઈ જવી અને માથે પાણીના ધૂંઠા પી જવા. અમે આ રીતે ગોળી બેતા હોઈએ તે જોઈને જેનારાને ખૂબ આશ્વર્ય થાય. એમને એમ થાય કે સાધારણ ગોળી તો હીક પણ કરવી જેરં જોવી ગોળીઓ પણ યુદ્ધ ચાવીને ખાઈ જાય છે! તો, અત્યારે જ્યારે ગોળીને કરડીને ખાતા હોઈએ ત્યારે બચપણાનું એ દશ અમારી નજર સમકાન તરફે છે. નેમ જવેની, કે પેંડો, કે ગોળ પડ્યો હોય એ લઈને છોક્કું ભાગે એમ અમે બા પાસે પડેલો કાચકાનો ટુકડો લઈને ભાગતા અને કરડીને ખાઈ જતા. એ વખતની જે કુદરતી બજિશ તે અત્યારે ખૂબ જ રાહતકર્તા થઈ ગઈ. હવે જમે એવી ગોળી હોય તો અમે કરડીને ખાઈ જઈએ છીએ, એમાં એમને જરાય મુશ્કેલી લાગતી નથી. તો આ પણ એક બચપણાનું સંભારણું છે. અસ્તુ.

### જીવનપાથે

(૨) કોઈની પણ મજબૂરીનો લાભ બેબો એ ખૂબ ખરાબ ગણાય છે. શા માટે? એટલા માટે કે કોઈની મજબૂરીનો લાભ બેતાં પહેલાં આપણે આપણને ખૂબ તેયાર કરવા પડે છે. આપણા સ્વભાવમાં નિષ્ઠરતા લાવવા માટે થઈને આપણે ખૂબ તેયારી કરવી પડે છે. આપણા આત્માનો જે મૂળ સ્વભાવ - ઝડપાણ; એ બંનેને આપણે આપણા લાધે જ રહેસી નાખવાં પડે છે. સામાને આપણે જોટલું નુકસાન કરીએ છીએ એના કરતાંય આપણને પોતાને આપણે જબરદસ્ત નુકસાન કરીએ છીએ. આ રીતે આપણે આપણા આત્માની જ

હત્યા કરીએ છીએ - આપણા આત્માને જ આપણે રહેસી નાખતા હોઈએ છીએ. આ સૂક્ષ્મ વાતોને એ સમજુએ તો આપણને ખબર પડે કે કોઈની પણ મજબૂરીનો લાભ બેબો એ આપણા માટે ખરાબ છે. એ બીજાને નુકસાનકર્તા છે એટલું જ નથી પણ આપણા પોતાના માટે તો જબરદસ્ત નુકસાનકર્તા છે. આપણે આપણા સ્વભાવ વિરુદ્ધ થવા માટે થઈને આપણે આપણી શક્તિને ઘણ્ણી બધી વેદી નાખવી પડે છે, ત્યારે આપણે નિષ્ઠુર જની શકીએ છીએ, ત્યારે આપણે આપણા સ્વભાવની વિરુદ્ધ જઈ શકીએ છીએ. અસ્તુ.

(૩) મતબેદ ભવે પડે પણ મતબેદ ન પડવો જોઈએ. મતબેદ પડે એ ઘણ્ણું મોટું નુકસાન છે. મતબેદ પડે એની સાથે સાથે મતબેદ પડેલો એમ સમજવાનું કે આપણી સમજાણ હજુ કાચી છે, હજુ આપણે અપરિપક્ષ છીએ, હજુ આપણે મનુષ્યજનની સાર્થકતા થેમાં છે એની સમજાણથી રહિત છીએ; ભવે આપણે આપણને પોતાને ખૂબ બુદ્ધિશાળી અને ડાખા સમજતા હોઈએ પરંતુ ખરેખર આપણે બુદ્ધિહીન છીએ, સમજાણ વિનાના છીએ. મતબેદ પડવો એ તો સ્વભાવિક છે. આવડી મોટી છઘસુદ્ધિ, આટલાં બધાં અગાજિત મસ્તકો! એટલે સૌનો મત જુદો હોઈ શકે. આપણો મત રન્ધુ કરીએ એ વખતે આપણાથી ભિન્ન મતના હોય એના તરફ અથવા એમને આપણા તરફ મતબેદ ન થવો જોઈએ. મનુષ્યજનમ સફળ અને સાર્થક કરવા માટેના આ ઉત્તમ સદ્ગુણો છે જે મનુષ્ય અવશ્ય કેળવવા જોઈએ. અસ્તુ.

### બચપણનાં સંભારણાં

(૪) (તા. ૧૮-૧૯-૨૭) અત્યારે અમારી તથિયત નરમ છે. ઓગષ્ટની પહેલી તારીખે ડાખી આજના મોતિયાનું ઓપરેશન કરાયું. પછી હોસ્પિટલમાંથી સીધા જ ડોક્ટર સોમાલાઈ પટેલ (દા. સદગુરુસમપાણિલિસ્ટ)ના હેર આવી ગેવલા. તે દિવસના અમે ટેક્ટરસાહેબના હેર જ છીએ અને એમનું આપણું કુંઠલ સેવાનો લાભ લઈ રહ્યું છે. અહીં રોજ રાતે નાગ-ચાર આધ્યાત્મિક મિન્નો બેસવા આવે છે, અમારો સમય પસાર કરાવવા આવે, એ લોકો આવે ત્યારેક અમે સૂતા હોઈએ તો ઝારેક બેઢા હોઈએ. અમે ચૂપચાપ બેઢા હોઈએ એટલે એ લોકો પણ મૂંગા મૂંગા બેઢા હોય. અમે એમને ખૂબ આશ્વ કરીએ કહીએ કે 'તમે લોકો જે હીક પડે તે વાતો કરો - તમારી

નોકરીની, તમારા વેપારધ્યાની કંઈ વાતો કરો તો અમારું ધ્યાન તમારી વાતોમાં ખેચાય અને તો અમારી તકલીફ થોડો સમય ભુવાય.' એક દિવસ અમારા આધ્યાત્મિક મિત્રો વાતોએ ચડી ગયા, હું એક બાજુ પડાયું ફરીને સૂતેલો હતો. તેઓ જગતમાં ચાલતા વહેલો, ભૂમો અને અંધશાનાઓ વિપેની વાતો કરતા હતા અને પોતપોતાને થેલા અનુભવોની એકબીજાને જાગુ કરતા હતા. તેમના અનુભવો સાંભળીને અમને અમારા નાનપાણનો એક કિસ્સો યાદ આવી ગયો. જો કે આમ તો એ વાત અમને અમેરિકાના વેસ્ટ વન્ડિનિયા સ્ટેટમાં યાદ આવેલી. કારાગુંકે ભૂતકાળના એ પ્રસંગ વખતે ને બાઈ અમારી સાથે હતા તે અમેરિકામાં જ સ્થાપી થેલા. તેમનું નામ બળવંતભાઈ બડું. અમેરિકામાં અમે એમને હોન કરીને પૂછ્યા કે તેમારે અમને ઓળખા કે નહીં? કારાગુંકે વર્ષો પછી હોન પર મળવાનું થયું. જો કે બળવંતભાઈ અમને તરત ઓળખી ગયા અને હોન ઉપર જ કહ્યું કે, 'હા નુરુજુ! આપણે કાળીચૌદશના દિવસે હળવદના સ્મશાનમાં ગમેલા એ વાત મને બારાબર યાદ છે.' હળવદનો એ પ્રસંગ આ મુજબ હતો -

એ વખતે અમે અમારી યુવાનીની ઉમર કરતાં થોડા નાના હોઈયું. અમારા મિત્રો, નંદલાલ દવેકે ને અત્યારે મુંબઈમાં એડ્વોકેટ છે અને બળવંતભાઈબડું કે હાલમાં પરિવાર સહિત અમેરિકામાં છે, તેઓ એમ માનતા કે કાળીચૌદશને દિવસે સ્મશાનમાં ભૂત થાય અને એ દિવસે આપણને ભૂત જેવા પાણ મળે. આવી બધી વાતો અમે બચપણથી જ ઓછી માનીએ. માતાપિતાના અને મોસાળના ઉચ્ચ આધ્યાત્મિક સંસ્કારોને કારાગું અમે આવી વાતો માનતા નહીં અને બીજાને પાણ એવી વાતોમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરતા. તેથી જ અમે અમારા મિત્રોનો ભ્રમ બાળવા કશ્યું કે ચાલો, કાળીચૌદશના દિવસે જ આપણે સ્મશાનમાં જઈએ અને ભૂતને નજરે જોઈએ. નક્કી કરેલા સમેયે અમે નાગે જેગા થયા. સાથે લાકડીઓ, છરીઓ, બેટરી વ. લીધા. અમે એ બંનેને સૂચના આપી કે 'તમે બંને એવું કંઈ જુઓ તો ભડકીને ભાગી જતા નહીં' કે અમને વળજી પડતા નહીં. પૂરી ડિમત રાખજો.' એમ કહી અમે એમને માનસિક રીતે તેથાર કર્યા. અમે હળવદના સ્મશાન તરફ ચાલવા લાગ્યા. તે કાળનું હળવદનું સ્મશાન એટલે દિવસે પાણ બયંકર લાગે! અત્યારે તો એ સ્મશાન વેદુંધામ જેવું થઈ ગયું છે. પાણ એ વખતનું સ્મશાન એટલે મહાભયંકર બિહામાણું. ધ્યાન મોટા વિસ્તારમાં અનેક પ્રકારની

નાની-મોટી શૂરા-સતીની દેરીઓ; કેવળ પથ્થરથી જ બનેલી. અજિંદાદ આપવાની બબ્ય છાપરી. એક દેરી સોળ થાંભલાવાળી, જે સોળસંભળિના નામે ઓળખાયા. તેની પગ લોકવાયડા એવી કે તે દેરી એક રાત્રીમાં જ તેથાર કરી નાભેલી. વળગાડવાળી વજિને તેમાં બેસાડે તો તેનો વળગાડ દૂર થઈ જાય. બવાની-ભૂતેશ્વરનું ભબ્ય-વિશ્વાળ મંદિર. એ કાળમાં તો એ મંદિર એવું અવાપું અંમાયિયું પરી રહેતું કે તેમાં પગ મૂકતાં જ હદ્ય પડકવા લાગે. જે પગલાં અંદર પ્રવેશીએ કે તેમાં ધામા નાખીને લાંબા સમયથી રહેલાં પછીઓ પાંખો ફક્કાવતાં બહાર નાસવા લાગે. બિહામાણ વાતાવરાશુમાં આવો ઓચિંતો ફક્કાટ સાંભળીને હેલતાઈ જવાય. કોઈ પક્કી આપણા માથે બટકાઈ પાણ જાય. તે વખતે આપણી રાડ ક્ષાટી જાય. નીચે ફર્શ ઉપર તો બકરીની લીઠીઓની પથારી પથરાપેલી હોય. આવું સ્મશાન જોંગે જેવું હોય તે અત્યારે જુબે તો તેને તે વેદુંધ જેવું લાગે. સ્મશાનનું નામ છે "રાનેશ્વર". અત્યારે ત્યાંની બધી વિવસ્થા જેતાં 'રાનેશ્વર' નામ સાર્થક લાગે. હન્દુ અત્યારે પાણ રાનેશ્વરની બબ્યતા એવી જ જીવનવાઈ રહી છે. એ બબ્યતાનો આસવાદ માણવા એક વખત રૂખરું મુલાકાત વેવી જોઈએ. તો જ અભર પડે કે હળવદના રાનેશ્વરની બબ્યતા કેવા પ્રકારની છે! અસ્તુ.

એ બધું દિવસે પાણ ભયંકર ડરામાણું લાગે ત્યાં રાતની તો વાત જ શું કર્યો! ? તો, એવા ઉરામાણા સ્મશાનમાં અમે કાળીચૌદશની રાને ગયા. સ્મશાનમાં જઈ બેટરી ચાલુ કરી અમે દેરીએ દેરીએ ફ્યા. ચારે બાજુ બધી ચંક્કર માર્યા. ક્યાંય ભૂત-પલિત દેખાયું નહીં. સ્મશાન આખું ખૂંદી વણ્ણા પછી મોડી રાને અમે પાછા આયા. તો આમ, અમારા મિત્રોના મનમાંથી વહેમ દૂર કરવાનો અમે સક્રિય પ્રયત્ન કર્યો.

અમે અમેરિકામાં હતા ત્યારે ઉપરોક્ત પ્રસંગની યાદ બળવંતભાઈએ હોન ઉપર આ પ્રસંગ સિવાયની બીજી પાણ એક વાત યાદ કરાવી. તેમારે અમને હોનમાં જાગાયું કે - 'મારાં લગ્ન થયાં ત્યારે હું અને મારાં પણી આપને મળવા આવેલાં. મારાં પણી એ વખતે ખૂબ દૂબળાં, વધુ પડતાં દૂબળાં. તેમને જોઈને આપે કહેવું કે અરીસાની સામે ઊભાં રહી ખૂબ હસો, ખૂબ હસો. આપે કશ્યા મુજબ અમે એ પ્રયોગ પાણ કરેલો. જે કે અત્યારે તો મારાં પણી એટલાં બધાં જાડું છે કે નેઠાં હોય તો ઊઠીય નથી શકતાં!' હોન ઉપર બળવંતભાઈની આ વાત સાંભળી અમને કહેવાનું મન તો થયું કે હવે તમારાં

પત્નીને કહો કે આરીસા સામે તિબાં રહી ખૂબ રહો, ખૂબ રહો; નેવું એકશન તેવું તેનું રિએક્શન. પરંતુ આવી વાત બેમને થોડી કહેવાય ?

તો આમ, ડોક્ટરસાહેબને ત્યાં ભક્તો વહેમો અને ખ્રમોની વાતો કરતા હતા તેથી ઉપરોક્ત વાતો યાદ આવી ગઈ, અસ્તુ.

### જીવનપાથેય

(૫) કોઈ માણસને તુંવાડે તુંવાડે ઈધા વાપી જાય તો એની સાથે સાથે એના તુંવાડે તુંવાડે કોથ પાગ વાપી જાય. અને જેના તુંવાડે તુંવાડે કોથ વાપી જાય એને પછી તુંવાડે તુંવાડે ગાંડપાગ ચહે, ગાંડપાગ વાપી જાય, જેના તુંવાડે તુંવાડે ગાંડપાગ વાપી જાય એનું હોય એ શું બોલશે, એ શું બક્ષે એનો કંઈ નેઢો ભરો ? તેથી ‘અમુક માણસ અમુક વખતે મને આમ કહી ગયો હતો, મને આવું મહેશું મારી જથો હતો, મને આવાં ખરાબ વાઝો કહી જથો હતો’ એમ એને જે યાદ કરીકરીને આપણે દુઃખી થઈએ તો પછી આપણે ડાદ્યા શાના કહેવાઈએ? જેના તુંવાડે તુંવાડે ગાંડપાગ વાપી જાય છે એ ગાંડો માણસ તો જમે તે પ્રકારનો બક્ષાસ કરે. એ વખતે એને બાન જ આં છે ? એ વખતે એને વિશેક જ આં છે ? તમામ વિશેકને વીસરી જથો છે એને એ અવસ્થામાં એ બોલી રહ્યો છે. બોલી રહ્યો છે એમ કહેવા કરતાં એ કહીએ કે એ બંકી રહ્યો છે - નેભાન અવસ્થામાં. એટલે એ વખતે એ ને કાઈ બોલતો હોય તેનું આપણે દુઃખ ન લગાડતું જોઈએ એને એ વાતને વાંબા સમય ચુંધી યાદ પાગ ન રાખવી જોઈએ. તો જ આપણે ડાદ્યા કહેવાઈએ. નહીં તો એથ ગાંડો એને આપણેય ગાંડા. એનામાં એને આપણામાં ફક્ત શું ? એ તો અત્યારે ઈધા, કોથ અને ગાંડપાગના આવેગમાં સંપૂર્ણ બેભાન છે. એને લાલ અને લાલનિ ભાબતનો કોઈ જ વિચાર નથી, એ વિશેકાંખ થયેલો છે. એ તો અંદરથી જે વેગ આવી રહ્યો છે એને તાને થઈ રહ્યો છે. પરંતુ આપણે તો એ વખતે વિશેકશીલ હતા. તો આપણે એ વખતે વધુ સાવધાન રહેવું જોઈએ. અસ્તુ.

### પ્રેરાગાદાયી સ્વર્ણ

(૬) (તા. ૨૦-૯-૮૭) પંકલભાઈ અને દામોદરભાઈ મળવા આવ્યા હતા. અમે ભાગોરનું ભોજન લઈ અને ઘડીક આરામ કરતાં તા. એમનો સમય થયો એટલે એ બંને ગયા. અમે ઘડીક વાંબો વાંસો કરવાનું વિચાર્ય. વાંબો વાંસો કરતી વખતે જીવન

આવી જાય તેની અમે કાળજ રાખીએ છીએ. જે દિવસે જીવ આવી જાય છે તો શરદી થઈ જાય છે. અમે લાંબો વાંસો કર્યો. થોડા સમય પછી સહેજ જાહેર આવી ગઈ, એમાં આવું સ્વર્ણ આવી ગયું -

નાના છોકરાને જે બાબાગાડીમાં બેસાડે છે એવી બાબાગાડીમાં નોંધ છીએ અને બાબાગાડીને આધીપાછી આધીપાછી કરીએ છીએ. આમ કરતાં કરતાં જ્યાં પાછળાની બાજુ અમે નજર કરી ત્યાં જેવું કે મુજાનંદબાબા એવી જ બાબાગાડીમાં બેઠેલા છે અને અમારી તરફ ખૂબ જરૂરી આવી રહ્યા છે. તેઓ થોડે જ દૂર રહ્યા એટલે અમને જરૂર લાગ્યો કે હમણાં ભટકાશે, હમણાં ભટકાશે. અમે એમને એટકાપવા જેર જેરથી ખૂબો પાડી - સાહેબ... સાહેબ... સાહેબ... ત્યાં તો ભડી દઈને એ ભટકાગું. અમારા ઉપર નજર પડી એટલે કહે ‘અરો યોગમિશ્શુ....’ એમ કહીને લા... લા... કરીને લસ્યા અને પોતાની ગાડી આગળ ચલાવવા લાગ્યા. તે વખતે પાગ હાથ વાંબો કરીકરીને અમે કંદું કે સાહેબ... સાહેબ... ઘડીક જીભા રહ્યો હતો એ તો આગળ નીકળી જ ગયા. જે ઘડીક જીભા રહ્યા હોતો તો, પંદર દિવસ પહેલાં અમને એમનું જે સ્વર્ણ આવેલું એનું રહ્યસ્ય એમને પૂર્ણવાની અમારી ઈચ્છા હતી. પરંતુ એ તો આગળ નીકળી જ ગયા. અસ્તુ.

(૭) (એક ભક્તને આવેલું સ્વર્ણ) ગદ્ધકાલે ખરેરાવપુરાથી માધ્યાભાઈ અને બળદેવભાઈ અમારી તબિયત જોયા આવેલા. ઘડીક જોંધ પછી તેઓ વાતે વળજ્યા. વાતો કરતાં કરતાં બંને ખૂબ હીલા હીલા થઈ ગયા, રહુ રહુ થઈ ગયા. પછી બળદેવભાઈએ ગળગળા થઈને વાત કરી કે -

“બાપુ ! મને આપનું સ્વર્ણ આવ્યું હતું. આપ જાગે ખબુ બીમાર છો અને મારા ખોળામાં સુતા છો. થોડી વાર પછી મેં જેવું તો આકાશમાં એક સુદર્શન ચક ફરફર ફરફર ફરતું હતું. થોડા સમય પછી મને એક મહાપુરુષ દેખાયા. જે હાથ જોઈને મેં મહાપુરુષને પ્રાર્થના કરી કે, હે દેવ ! મારા ગુરુજીને સાખ કરી દો. એટલે એમારે વરદ હસ્ત ધર્યો અને આપ સાખ થઈ ગયા. પછી મેં બીજી માંગણી મૂકી કે, હે દેવ ! મને જન્મોજીનું આ જ યુરુજુ મળે એવું વરદાન આપો. આ સાંભળી મહાપુરુષ હસવા લાગ્યા અને હસતા હસતા કહે કે ‘તારે તો હજુ ધારા જન્મ લેવાના છે અને તારા ગુરુજીનો તો આ છેલ્લો જન્મ છે !’ તેમની પાસેથી આવું સાંભળ્યું છતાં પાગ ફરોકરીને મેં પ્રાર્થના કરી કે -

એ ને હોય તે; અમારી મને વધુ સમજાણ પડે નહીં, પરંતુ મને મારા આ ગુરુજી જ જન્મોજન્મ મળે એવું વરદાન આપો જ, પછી મારું સ્વપ્ન પૂરુષ થઈ ગયું.”

આટલું કહેતાં કહેતાં તો એમ થોડો જગતગળો થઈ ગયો અને અમેય થોડા જગતગળા થઈ ગયા. અમે વિચાર કરવા લાગ્યા કે આ જામડાનો ખેડૂત! એને તો ભળાન, ને લળ, ને સાંતીઠું, ને જર્મીન, ને ખેતર, ને પાદર, ને એના સપનાના આવવાનો જોઈએ. કારણકે એ દિવસ-રાત એમાં જ મચ્છી પદ્ધો હોય છે. એને બદલે - ઝાં ગુરુજી, ને ઝાં ગુરુજીની બીમારી, ને ઝાં એ મહાપુરુષ, ને ઝાં એમની પાંચે એની પ્રેરાગાદાખી માંગણી - આ જથો વિચાર કરીએ તો એમ લાગેકે એના સૂક્ષ્મ શરીરમાં કેવી ગુરુનિષ્ઠા જાગેલી! એના પરિણામે જ તેને આવું દિવ્ય સ્વપ્ન આવ્યું ને!? અસ્તુ.

## ગુરુનિષ્ઠા

(૮) (તા. ૨૨-૧૮-૫૭) અમારી તબિયત નરમગરમ રહે છે એટલે અમે ડૉ. સાદગુરુસમર્પણબિજુજીના ઘેર રોકાયા છીએ. અહીં રાતે ધાર્યાં આધ્યાત્મિક મિત્રો મળવા આવે છે. ચાર- પાંચ દિવસ પહેલાં સુજીબેનના દાદા આવેલાં. સુજીબેન એટલે સુનીલભાઈનાં ને વર્ષનાં દીકરી અને સુનીલભાઈ એટલે ડોક્ટરસાહેબના સગા ભનીઅ. તો, એ સુજીબેનના દાદા અમારી અભર કાઢવા આવેલાં થોડો સમય બેઠા પછી કંઈક વાત નીકળી એટલે એમાગે કહેવા માંજ્યું કે -

“આ સુજી મારા ઘરે આવી” તી. ઘેર ભજન ચાલતાં ‘તાં એટલે મેં કહ્યું કે, સુજી બેટા! ભજનની સાથે તું તાલીઓ પાડ. પાગું સુજીએ તાલીઓ પાડી નહીં. આ જોઈ સુજીનાં મમ્મી કહે કે, ‘તમે ઓમ્ન નમ: શિવાય મંત્રની ધૂન બોલો. નુંઓ, એ તરત તાલીઓ પાડશે.’ એટલે અમે ઓમ્ન નમ: શિવાય મંત્રની ધૂન બોલા, તો યે તોણે તાલીઓ ના પાડી. પછી એનાં મમ્મી કહે, ‘એમ નહીં, અમારા ગુરુજી જે દાળમાં બોલે છે એ દાળમાં ધૂન બોલો; તો એ તાલીઓ પાડશે.’ આ સાંભળી અમે સૌ, આપ જે દાળમાં ઓમ્ન નમ: શિવાયની ધૂન બોલો છો એ દાળમાં બોલવા માંજ્યા; એટલે તરત જ સુજી તાલીઓ પાડવા લાગી.”

સુજીના દાદાએ કહેલી આ વાત સાંભળીને અમે ઘડાડાટ અહૃતાસ્ય કરી ઊઠ્યા. અને પછી અમને વિચારો આવવા લાગ્યા કે આ ઘરમાં ગુરુનિષ્ઠા કેવી પનાપી છે, કેવી

પાંચરી છે! ધરની અંદર ચોરાગું વર્ષના માઝથી માંડી આવડી નહીં એ વર્ષની દીકરી - એ બધામાં કેવી ગુરુનિષ્ઠા છે! આમ તો અવારનવાર આપાગે ભજન જાતા હોઈએ છીએ, સાંભળતાં હોઈએ છીએ કે “રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં.” પરંતુ રંગાઈ જાવું કાઈ સહેલું પરજું છે? ! આ ઘરમાં તો ફક્ત ભજન જાવાનાં નથી, અહીં તો બધાં નંબું જીવન જ એ પ્રમાણેનું છે. અહીં તો બધાં ગુરુનિષ્ઠાના રંગમાં રંગાઈ ગયાં છે. અને ગુરુનિષ્ઠા એટબે શું? ગુરુનિષ્ઠા એટબે શું કોઈ વ્યક્તિમાં અંધબદ્ધ? શું આંધળા થઈ કોઈ વ્યક્તિ પાછળ દોડવું? ના, એવો અર્થ અમે નથી કરતા. ગુરુનિષ્ઠા એટબે તો સાચી સમજાણ, ગુરુનિષ્ઠા એટબે તો સાચું જ્ઞાન; ગુરુનિષ્ઠા એટબે તો મનુષ્યજીનું સાર્થક અને સફળ કરી રીતે કરી શકાય તે અગેની વાતોને સાવધાનીપૂર્વક સાંભળવી, જાળવી અને જીવનમાં ઉત્તારવી. એ સમય બાબતોનો સમાવેશ અમે ‘ગુરુનિષ્ઠા’ શબ્દમાં કરીએ છીએ. ‘ગુરુનિષ્ઠા એટબે કોઈ વ્યક્તિ પાછળ આંધળા થઈને દોડવું’ એવો વિકૃત અર્થ અમે નથી કરતા. તો ડોક્ટરબિજુજીના કુટુંબમાં સાચી ગુરુનિષ્ઠા જેઈ કોને હર્ષ ના થાય? અમને તો હર્ષ થાય જ પાગ તમે સૌ આ કિસ્સો સાંભળશો-વાંચશો તો તમને પાગ ખૂબ ખૂબ હર્ષ થશે, આનંદ થશે અને પ્રેરણા મળશે, અસ્તુ.

## જીવનપાથ્ય

(૯) મનુષ્યમનનું, મનુષ્યસ્વભાવનું ઘડતર જ એવા પ્રકારનું છે કે એ સતત વાતો કરતો જ રહે છે. પરંતુ જ્યારે એ વાચિક વાતો કરે જ્યારે આપાગે સાંભળી શકીએ અને આપાગે કહીએ કે એ વાતો કરે છે. પાગ જ્યારે એનું મોહું બંધ હોય ત્યારે પાગ એની વાતો તો ચાલુ જ હોય છે, એ માનસિક રીતે વાતો કરતો જ હોય છે. તો, એ વાચિક રીતે વાતો કરવાનો મોકો એને લાંબા સમય સુધીની ના જ મળે અને ધાર્યા લાંબા સમય સુધી એ માનસિક વાતો જ કર્યા કરે તો એમાંથી ગાંડપાગ થઈ જવાની સંભાવના રહેલી છે. તેથી અમુક સમયે તેને વાચિક વાતો કરવાનો મોકો મળવો જ જોઈએ, તો જ માનસિક વાતોનો ખુલાસો (નિકાલ) અમુક અમુક સમયે થયા કરે. જે કે આ વાત સૂક્ષ્માતિશૂક્ષ્મ છે તેથી સહેલાઈથી સમજાય એવી નથી. તેથી થોડાં સ્થ્રોળ દાસ્તાંનો દ્વારા એ વાતને સમજાવાનો પ્રયત્ન કરીએ.

નેમ પેટમાં ગેસ થયો હોય અને ગેસની છૂટ - વાદ્ધાટ ના થાય તો કેટલા આકળવિકણ થઈ જઈએ છીએ ! એ ગેસ છૂટી જાય તો જ આપાગુને શાંતિ થાય છે ને ? નેમ જીવ ચુંથાનો હોય અને ઊલટી થશે, ઊલટી થશે એમ થતું હોય ન્યારે અને ઊલટી ના જ થાય નારે આપાગુની એટલી હાલત હોય છે ?! અજરૂમાં જઈએ પણ મળનો ખુલાસો ન જ થાય અને એવું થોડો વધુ સમય રહે તો કેટલા બેચેન થઈ જઈએ છીએ ! અને એથી પણ વધુ સમય એ જ સ્થિતિ રહે તો ચિત્ત ઉપર, મન ઉપર તેની એટલી વિકૃત અસર થાય છે ! જો એનો ખુલાસો થઈ જાય તો જ શાંતિ થતી હોય છે, એવી જ રીતે, સતત માનસિક વાતો ચાલતી જ રહે, ચાલતી જ રહે તો એનો ખૂબ ભરાવો થઈ જાય, અને તેથી મન અને મગજ ઉપર એની ખૂબ વિકૃત અસર પડે, આના કારણે પછી ચિત્તભ્રમ થઈ જવાની સંભાવના. એટલે થોડા થોડા સમયે વાતોચીતો કરી જ લેવી જોઈએ, વાતોચીતો કરવાનો મોક્ષો મળવો જ જોઈએ. એમાંથી જે મનગમતી અને આનંદદાયક વાતોચીતો થાય તો ખૂબ સારો એવો ખુલાસો થઈ જાય, અને તેથી મન અને મગજ ઉપરથી બોજ સાવ જિતરી જાય, બધું સાવ હલદું થઈ જાય. આ બધી વાતો મનોવૈજ્ઞાનિક છે અને અનુભવીઓએ આચરવા નેવી અને સમજવા નેવી છે; તેથી બીજાઓને પણ વાચિક વાતોચીતો કરવાનો આપાગુની મોક્ષો આપીએ અને એ રીતે સમજમાં સુખશાંતિનો ફેલાવો કરી શકીએ.

અમુક ગાંડા થઈ ગેલા માગસો પ્રારેક ક્રારેક ખૂમાખૂમ અને રાડારાડ કરતા હોય છે. જાણેઅજાણે તેઓને અંદરથી એવી પ્રેરણ થાય છે. વીતી ગેલા જીવનમાં કોઈ દબાણને કારણે કે જમે તે કારણવશ એમને વધુ પડતું મૌન રહેવું પણું હોય છે. એની વિકૃત અસરના કારણે એમની ચિત્તભ્રમની અવસ્થા થઈ ગઈ હોય છે. આ (ગાંડપાગની) અવસ્થામાં પછી કોઈનું દબાણ રહેતું નથી, તેથી ન્યારે ન્યારે આવેગ ચેરે એટલે જેરનેરથી રાડો પાડે, ભરાડા પાડે; અને થોડી વાર એમ કરે એટલે, માનસિક ભરાવાના નિકાલના કારણે એમને તત્પૂરતી શાંતિ થઈ જતી હોય છે. આમ, આ વાતને એટલાં દધાંતો આપીને સમજાવીએ એટલી વધુ સમજાગુની પડે પણ આટલાથીય ધારુંની બધી સમજાઈ જાય છે.

ઉપરોક્ત વાતો સાંભળીને આપાગુના મનમાં એક પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે - જે લોકો લાંબા સમય માટે મૌનપ્રત ધારણ કરે છે તેમને શું લાભ ? એ મૌનથી તો નુકસાન જ છે ને ?

આવો પ્રશ્ન થબો સ્વાભાવિક છે પરંતુ એને આ રીતે સમજ શકાય, એવું સમાધાન આ રીતે થઈ શકે કે -

દબાણપૂર્વક મૌન રાખવું પડે એ અને ઈચ્છાપૂર્વક મનને કેળવવા માટે મૌનપ્રત ધારણ કરીએ એ - આ બંને પ્રકારના મૌન સાવ જુદાં જ છે. મૌનપ્રત તો આપાગુની પોતે ઈચ્છાપૂર્વક ધારણ કરેવું છે; એ મરનિયાત છે, ફરનિયાત નથી. 'આપાગુન મન ઉપર કેટલો સંયમ રાખો શકીએ છીએ, મનને કેટલું કેળવી શકીએ છીએ' એ બધી ગાગતરીઓ મૌનપ્રતનું પાલન કરનારના મનમાં હોય છે. જો કે એમાં પણ શરૂઆતના ન્યારેક દિવસ તો બહુ લાભ નથી થતો, કારણેકે વર્ષોની બોલવાની આદતને લીધે હર કારો, હર પગે અંદરથી બોલવાનો વેગ ચડતો હોય છે અને એને આપાગુની રોકવો પડે છે, એને આપાગુની મઠારવો પડે છે, એવું મૌનપ્રતના શરૂઆતના ન્યારેક દિવસ બનતું રહે છે, જેને કારણે મૌનનો પૂરેપૂરો લાભ મળતો નથી. ન્યારેક દિવસના મૌનના અભ્યાસ પછી મન કેળવાય છે, જેથી બોલવાનો વેગ ચડતો નથી. તેથી જ ન્યારું દિવસ પછી જ મૌનપ્રતનો સાચો લાભ આપાગુને મળવા લાગે છે. કારણેકે મૌનપ્રત ધારણ કરવાનો ઉદ્દેશ એ છે કે બોલવામાં જે શક્તિઓનો જાપ થાય છે, જે શક્તિઓ વપરાઈ જાય છે એનો સંશોધ કરવો, એને વપરાતી અટકવીને એનો સંશોધ કરવો. આપાગુની જાણીએ છીએ કે એક શબ્દ પણ બોલવો હોય તોય એની પાછળ આપાગુન મગજને કેટલું કાર્ય કરેવું પડતું હોય છે અને એનો એટલો બધો શ્રમ પહતો હોય છે! તેથી એ બધા શ્રમમાંથી મગજને થોડો આરામ મળે એટલા માટે જ આપાગુની મૌનપ્રતને ધારણ કરવાનું હોય છે અને એનો લાભ ન્યારેક દિવસ પછી મળવાની શરૂઆત થઈ જતી હોય છે. તો આમ, મૌનપ્રત ઈચ્છાપૂર્વકનું મૌન છે, મરનિયાત મૌન છે; એ એવું મૌન નથી કે જે કોઈના દબાણ વારા પાળવું પડતું હોય અને જેની વિકૃત અસર થાય, મૌનપ્રતમાં તો લાભ જ થાય છે. અસ્તુ.

(૧૦) મનુષ્યના મનનું, મનુષ્યના સ્વભાવનું ઘઢતર જ એવા પ્રકારનું હોય છે કે અતિ વિશ્વાસુ માણસ હોય એના તરફ એને અવિશ્વાસની કલ્પનાઓ થવા લાગે અને સંપૂર્ણ અવિશ્વાસુ હોય એના તરફ એને વિશ્વાસની કલ્પનાઓ થવા લાગે.

આવું હરેકને જુદાજુદા સમયે અને જુદીજુદી પરિસ્થિતિમાં થતું જ હોય છે, અનુભવાતું જ હોય છે. પરંતુ એ વખતે મન ભવે વિશ્વાસુમાં અવિશ્વાસ અને અવિશ્વાસુમાં વિશ્વાસ બેચેની ઝૂદાઝૂદ કરે પણ આત્મા તો અગૃત જ હોય છે. આત્માને તો સાચી વાતની જાબર પડતી જ હોય છે, આત્મા મન સાથે ઘસડાતો નથી. વિપરીત વિચારનું એ તો મનનું કર્ય છે. આત્મા તો એ વખતે સ્થિર જ હોય છે. તેથી સાવધાન મનુષ્ય એ છે કે જે મનની ઝૂદાઝૂદ અને આત્માની સ્થિરતાને જાગ્રી વે. સાવધાન મનુષ્યને એ વાતની જાબર છે કે મન ભવે જમે તેવા વિચાર કરે પણ

આત્માએ જે નક્કી કર્ય છે એ નિર્ગય ઉપર જ આખરે મનને ચાલવાનું છે. તો આમ, મનનો આવો સ્વભાવ છે. પણ મન સાથે આત્મા ભળી જતો નથી. એ તત્સ્થ રીતે બાબર વિચાર કરે છે કે કોણ વિશ્વાસુ છે અને કોણ અવિશ્વાસુ છે. કોનામાં કેટલો વિશ્વાસ રાખવો જોઈએ અને કોનામાં કેટલો અવિશ્વાસ રાખવો જોઈએ એની એને પૂરેપૂરી પ્રતીતિ છે. અને આવી પ્રતીતિ હોય એ જ એના જીવનમાં સાવધ રહ્યો કહેવાય. અને જે સાવધ રહે એનો જ મનુષ્યજન્મ સાર્થક થતો હોય છે. અસ્તુ.

## લિક્ષુ-નામકરાગ-દિવસનાં સંસ્મરણો

સંકલન : પંકજ શાહ

ઓમપરિવારના ઉપકમે દર વર્ષે ડિસેમ્બર માસમાં “ધજરોહાર”નો કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમનું નિમિત્ત છે “ગાયત્રી અનુષ્ઠાન સાધન શિબિર.” ધજરોહારના કાર્યક્રમની સાથે સાથે ‘લિક્ષુબોધોત્સવ’ કાર્યક્રમ પાણી જ દિવસે ઊજવાય છે. ઓમપરિવારના ગ્રાણ લિક્ષુઓ - (૧) શ્રી ગુરુપ્રેમલિક્ષુ (૨) શ્રી સદગુરુસમપીણલિક્ષુ (૩) શ્રી ગુરુધ્યાનલિક્ષુ. ૫. પૂ. ગુરુદેવ શ્રી યોગલિક્ષુજીએ જુદા જુદા પ્રસંગે ઓમપરિવારના ગ્રાણ સ્વર્ગસેવકોને ઉપરોક્ત નામ આપેલાં. લિક્ષુઓનો નામકરાગદિવસ ભૂતકાળમાં યોજાયેલો, કે જ્યારે “ઉત્તમભરા” સામયિક પ્રગટ નહોતું થતું. પ્રસ્તુત વેચ દારા આ સામયિકના વાંચકગ્રાણને ભૂતકાળના એ દિવસોની યાદ તાજી કર્યાવીએ.

૧૯૮૦ના વર્ષની મહાશિવરાત્રીનો (તા. ૧૪-૨-૧૦નો) એ પરમ પવિત્ર દિવસ હતો. શ્રી અનિબલાઈ દવેના ઘેર અંબાલાલ એસ્ટેટમાં તે દિવસે ‘સ્વાધ્યાત્મ-સન્સંગ-મિલન’નો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરિસ્થિત ગુરુભાઈબહેનો પૂજન્ય શ્રી યોગલિક્ષુજીના આદેશાનુસાર ગાયત્રીમંત્રનો જાપ કરી રહ્યા હતાં. પૂજન્યશ્રી કરી રહ્યા હતા -

“ગાયત્રીમંત્રનો શો અર્થ છે એ આપણે સૌ જાગ્રીએ છીએ. (ભાવાર્થ: એ સર્વબ્યાપ્ત પરમાત્મા, અમે તમારું ધ્યાન પરીએ છીએ. તમે અમારી બુલ્દિને પેરો, તમે અમારી બુલ્દિમાં વસો.) નેને ગાયત્રીમંત્ર આવડતો હોય તે આ અર્થનું રટાણ કરી

શકે. અમારું બોલવાનું ચાલુ જ રહેશે. તમે તમારા જાપ ચાલુ રાખો. જાપમાં તહીલન થઈ જવાય અને અમારું ન સંભળાય તો વાંધો નથી.

“મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં અર્જુનનો રથ ને સેનાની વચ્ચે ઉભો છે. એ રથની અંદર અર્જુન બિરાજમાન છે. સારથિની જગ્યાએ ધોડાઓની લગામ પ્રકડી શ્રીકૃષ્ણ નેટા છે. રથની ઉપરની ધયામાં હનુમાનજી છે. આ દશ શું કહી રહ્યું છે? આ શરીરરૂપી રથના ઈન્દ્રિયોર્પી ધોડાની લગામો પરમાત્માના હાથમાં સોંપવી. આ રહસ્ય જ ગાયત્રીમંત્રમાં રથમાયું છે.

“બાપની જમે તેટલી સંપત્તિ હશે, પરંતુ છોકરામાં જે બુલ્દિ નહીં હોય તો એને જમે તે રીતે ઉડાલી દશે. પરંતુ એને બુલ્દિની શુલ્દિનો વારસો એના પિતા તરફથી મળ્યો હશે - એના પિતાએ એને ગાયત્રીમંત્ર સાચા અર્થમાં શીખવી એની બુલ્દિની શુલ્દિ કરી હશે - તો એ સાવ ગરીબ અવસ્થામાં હશે તો પાણ બધું જ પ્રાપ્ત કરશે. પોતાનું કલ્યાણ પ્રાપ્ત કરશે, બીજાનું કલ્યાણ કરશે; બલુજાનહિતાય-બલુજાનસુખાયમાં જબરનસ્ત ક્ષણો આપશે. પરંતુ અસરે? જ્યારે એણે એની બુલ્દિની શુલ્દિ કરી લીધી હશે ત્યારે. શરીરરૂપી રથના ઈન્દ્રિયોર્પી ધોડાઓ ધૂટા છે. ધોડાનો તો શું વેગ હોય. એનાથી મનનો વેગ વધારે હોય છે. મન કરતાં પાણ અનંત ગાળો વેગ બુલ્દિનો છે. નિર્ગય વેવાનું કામ બુલ્દિ કરે છે. માટે જ ગાયત્રીમંત્રના જાપ દારા આપણે

પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આપણી બુદ્ધિમાં વસે, તેઓ આપણી બુદ્ધિને પ્રેરે.

“શરીર એ દશ ધોડાવાળો રથ છે, એમાં અજૂનદ્વિષી જીવ બેઠેલો છે, એ જીવ પરમાત્માને પ્રાર્થના કરી રહ્યો છે કે ‘હે પરમકૃપાણું પરમાત્મા, હું તમારું ધ્યાન કરી રહ્યો છું.’ ધ્યાનના ફળઝે એ જીવ શું ઈચ્છે છે? એને કોઈ બૌતિક વસ્તુ નથી જોઈતી. ધ્યાનના બદલામાં એ જીવ પરમાત્માને પ્રાર્થી રહ્યો છે કે ‘તમે અમારી બુદ્ધિને પ્રેરો, જ્ઞાતે એમે અમારી બુદ્ધિથી કામ કરતા હોઈએ ત્યારે તેમાં તમારી જ પ્રેરણા હોય, તમારાથી પ્રેરણેલી બુદ્ધિથી જ અમારા નિર્ણયો લેવાતા હોય.’ તો, શરીરદ્વિષી રથમાં બેઠેલો અજૂનદ્વિષી જીવ પોતાના ભધા ધોડાઓની લગામો ભગવાનને સુપ્રત કરી રહ્યો છે. પરંતુ ભગવાન પાણ વિચાર કરે છે કે મારે ક્યા રથના ધોડાની લગામ હાથમાં લેવાની છે? જે રથના ધોડાની હનુમાનજી બિરાજમાન છે તે રથના ધોડાની. હનુમાનજી એટલે વાસનાઓને હાણી નાને તે, કેવા? બજરંગ, જેનું અંગ વજનું છે, સંયમનિયમનું પાલન કરી, જોગે પોતાનું અંગ વજનું બનાવી દીધું છે. તો શરીરદ્વિષી એ રથમાં જીવ બિરાજમાન છે. એના વેગમાન ધોડાઓ એ રથને પૂર્ણાટ ધોડાવી રહ્યા છે. ખ્યારે કઈ તરફ તો ખ્યારે કઈ તરફ એની ગતિ છે, એ મોકા તરફ એની ગતિ હશે તો મોકા તરફ ફક્ફડાટ પહોંચાડી દેવાના, એ નક તરફ એની ગતિ હશે તો જોતજોતામાં નકમાં ફેંકો દેવાના. એ કઈ તરફ નશે એ એનું મોકું કઈ તરફ છે એના ઉપર અખલંબિત છે, ભગવાન એ રથનો કબજે ખ્યારે વે, એની લગામ સ્વીકારવાની સ્વીકૃતિ ખ્યારે આપે? રથ ઉપર જે હનુમાનજીની પજાફક્તિ હોય તો, એ હનુમાનજી બિરાજેલી ધજાના ફક્ફડાટથી વાસનાનાં, પ્રાંચનાં, બૌતિક સુખોનાં શિયાળિયાં બદકીને ભાગી જાય, દેતના પારેવડાં ઊડી જાય, અસ્તુ.

“આપ સો જ્યા કરતા જાવ એને સાંભળતા જાવ. સોનામાં સુગંધ બળી છે, એને ત્રીજું, આને શિવરાની છે. તેમે જ્યા કરતા જાવ એને સાંભળતા જાવ, પછી જુઓકે તમારા મનની તાકાત છે કે બીજે જ્યાંય આવુંપાણું થઈ શકે? અસ્તુ.

“હે સર્વચાપક પરમાત્મા, તમે જીવમાનને સાચાં એને પોતાં કર્માનાં ફળ આપનાર છો. કારણકે તમે સર્વજ્ઞ છો. તેથી કોઈ પાણ જીવ, જેમે તે જાયાએ, જેમે તેનું કર્મ કરે એની આપને બજર પડી જાય છે. એને તેથી તમે તેને અનુરૂપ ફળ આપી શકો છો. પુણ્ય કરે એને ચુખ એને પાપ કરે તેને દુઃખ, તમારા તરફથી

કર્મના અટલ સિદ્ધાંત મુજબ મળે છે. પુણ્ય કરેલું હોય તો વર્ચે કોઈ વાંચુરથત આપીને એના ફળને બદલાવી ન શકે, એ કામ આપે આપની પાંસે જ રાખ્યું છે. એ કોઈના હાથમાં સુપ્રત કર્મ નથી. ખાસેય નહીં કરો. કારણકે કોઈ એ કાર્ય નહીં કરી શકે. લીબોળી વાવો તો લીમડો જ થાય, જોટલો વાવો તો આંબો જ થાય; એ કર્મનો અટલ નિયમ છે. એ નિકાળ-અભાધિત, સૂક્ષ્માતિસૂક્ષ્મ નિયમ છે.

“તો, પરમાત્મા બધું જ જાણે છે, કારણકે એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ શાદી છે? કારણકે એ સર્વચાપક છે. એમનું મુખ્ય નામ ઓમ છે. હરિ તારાં નામ છે હજર. ક્યા નામે વખતી કંકોની? હરિનાં નામ હજરનહીં, અગણિત છે. બાવન અકાર, એ બધાં એનાં નામ છે. ‘નામ’ એને ‘રૂપ’ એ બધું જ એનું છે. બોધમાં પેસી ભોધરે, કરીએ કાંઈ કામ;

ક્યાથે જગકર્તા વિના, દાખલ ન મળે હામ.

“આકાશમાં ઊડી નાઈને, કે ભોંસરામાં પેસીને, કે સાતમા પાતાળમાં નાઈને જે કંઈ શુલ્લ-અશુલ્લ કર્મ કરીએ તેની પાણ એમને બજર પડી જાય છે. કેમ? કારણકે એ સર્વચાપક છે. પરમાત્મા કોઈ અમુક જાગાએ જ છે તેમ નથી. તેઓ સર્વચાપક છે એને તેથી સર્વજ્ઞ છે. એને તેથી શુલ્લ કર્મ કરનારને શુલ્લ એને અશુલ્લ કર્મ કરનારને અશુલ્લ ફળ મળતું રહે છે.

“આના દિવસના કાર્યક્રમમાં અન્યારે જન્યનો સમૃપ વહી રહ્યો છે. પ્રવચનનો સમૃપ સાંને રાખ્યો છે. તો, ફળ પ્રવચન જ સાંભળવાની ઈચ્છાથી કોઈ સાંને જ આવે તો સાંને એમે ન યે બોલીએ, બોલવાની ઈચ્છા જ ન થાય, બોલવાનો ઉકેલ જ ન પડે, પ્રેરણા જ ન થાય, ઉત્સાહ જ ન જાગે; આખા દિવસના કાર્યક્રમમાં ગમે ત્યારે બોલાઈ જાય. સમુદ્રમાં દૂબકી મારનાર મરછાઓ હજરો દૂબકી મારે એને એમાની મોદા ભાગની દૂબકીમાં તો એ છીપલાં જ લાવે છે. હજરો દૂબકીમાં કરોડો છીપલાં લાવે ત્યારે માંડ એક સાચું મોતી મળી જાય. એમ, આખા દિવસનો, આખા મહિનાનો કે આપી નિર્દિષ્ટાનો કાર્યક્રમ હોય એમાં એક જ મોતી હાથમાં આવી જાય એટલે અનંત જન્મોનો પાર મુકાઈ જાય છે. ગુરુજનોના સંપર્કમાં રહેવાથી એનેક મોતી મળતાં જ થઈ જાય છે.

“તમારો જાપ સુંદર રીતે ચાલી રહ્યો છે. તમે સાંભળી પાણ રહ્યા છો એને જાપ પાણ કરી રહ્યા છો. આ “ધારણા” નો

એક પ્રકાર છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારાગુણ, ધ્યાન અને સમાપ્તિ; એમ એનો કુમ છે. ધારાગુણમાં કઈ રીતે જીવાય? એમાં પાંચેય ઈન્દ્રિયોને પોતખોતાના વિષયો એવી રીતે સોચો દીઘિલા હોય કે પછી એ ઈન્દ્રિયોની તકાત નહીં કે મનને આંખ જેંચી થકે. ગુરુનનો પાસેથી ધારાગુણને ડેવી રીતે સિદ્ધ કરવી એ યુક્તિ જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે એ ધારાગુણ ડેવી રીતે કરવી એની ગમ પડે છે. નેમ કે :

- (૧) આંખ - પોતાના સદગુરુની મૂર્તિને જોઈ રહી હોય,
- (૨) જીબ - સદગુરુનો માનસિક જ્ય કરતી હોય,
- (૩) કાર્બુ - માનસિક જાપને સૂક્ષ્મ કાર્બુ સાંભળતા હોય,
- (૪) સ્પર્શન્દ્રિય - ગુરુદેવનો સૂક્ષ્મ સ્પર્શ અનુભવતી હોય,

- (૫) નાક - ઈન્દ્રિયની મૂર્તિ આગળ સૂક્ષ્મ અગ્રભસ્તી પ્રગટાવેલી હોય એની દિવ્ય સુર્ગધ લઈ રહ્યું હોય. આમ, દરેક ઈન્દ્રિયને અલગ અલગ વિષયોમાં રોકી રાખવામાં આવી હોય અને ધારાગુણ થયે જતી હોય. “દેશબંધ ચિનસ્ય ધારાગુણ”. ચિનને કોઈ એક પ્રદેશમાં બાંધી ટુંનું તે ધારાગુણ. “તત્ત્વ પ્રત્યેકતાનતા ધ્યાનમું” અને એ બાંધિલા ચિનને, એની બાંધેલી સુમધુરાદામાં વિક્ષેપ ન આવવો, એમાં અંબંદ્પાણું રહેવું, એ ધારાગુણ ઓક્તાન થઈ જાય તે ધ્યાન. અસ્તુ.

“આને શિવરાત્રી એટલે દિવસે અને રાતે એમ ચોવીસે કલાક લાભ ઉદ્ઘાવવાનો છે. શિવ અને શક્તિ ; જે શક્તિ હોય તો કલ્યાણ (શિવ) સાચી શક્તિએ અને કલ્યાણની (શિવની) ઉપાસના કરીએ તો શક્તિને મેળવી શકીએ. વિશ્વમાં અનેક પ્રકારની શક્તિઓ છે, શક્તિઓનો પાર નથી. આ, એમ બોલી રહ્યા છીએ એ વાણીની શક્તિ છે. તમે સાંભળી રહ્યા છો એ શ્રવાગુણને આભારી છે. પરંતુ મોટામાં મોટી શક્તિ આપાજે એને કહી છે? સહનશક્તિને. સહનશક્તિ મોટામાં મોટી શક્તિ છે. બીજી બધી શક્તિઓ તેની આગળ હાથ જોડીને ઊભી રહે છે.

“ગાયત્રી વાયતે ઈતિ ગાયત્રી: જેના ગાવામાનથી ગાનાસનું રાખા થાય છે, એને ગાયત્રી કહે છે. ગાયત્રીને આપાજે માતાજી કહીએ છીએ. એ સ્ત્રીવાચક શબ્દ છે, એ શક્તિની (મણ-તકાત-સામર્થ્યની) ઉપાસના છે. એટલે એને માતાજી કહ્યાં, તો,

અન્યારે તમે જો પાણ ગામની મેત્રના જ્ય દ્વારા શક્તિની ઉપાસના કરી રહ્યા છે. આજના કાર્યક્રમનું નિમિત્ત શ્રી વિનુભાઈ શાહનો વિદેશ-વિદ્યા-સમાર્થભ. આ કાર્યક્રમની સાથે એમે બીજે પાણ એક કાર્યક્રમ ગોઠવી દીખો છે, તેમને આધ્યાત્મિક નામ આપવાનો. બોલો “સદગુરુદેવની જ્ય, ધર્મગુરુદેવની જ્ય.”

“ઓમપરિવારની વજિ જ્યાં પાણ હોય, એથે સભામાં પ્રવચન પૂર્વે ઉપરોક્ત જ્ય બોલાવવાની હોય છે. “પરમાત્મીય, સદગુરુદેવભીઓ; સૌનું સ્વાગત, સૌને વંદન, જ્યગુરુદેવ, જ્યનારાયાણ.” ઉપરોક્ત હશે વિનુભાઈનું સભા-સંબોધન. વિનુભાઈ પ્રવચન કરતાં પહેલાં સભાને ઉપરોક્ત રીતે સંબોધથે. અને એમનું પરદેશનું ભાષું -

“દુનિયાની કોઈ તકાત લધુને ગુરુ બનતાં રોકી નહીં શકે; લધુ, ગુરુ બનીને જ રહેશે.” આ હશે એમનું ભાષું, એમનો ગુરુસંદેશ, ગુરુદેવ તરફથી તેમને સંદેશો, તેમના તરફથી લધુઓને સંદેશ; આ જ તેમનું હથિયાર, શક્તિ, બજિ, યુક્તિ-પ્રયુક્તિ; આ જ તેમને આશીર્વચન, આ જ તેમના જગતને આશીર્વચન. ગુરુદેવને સમર્પિત ધર્થને, ગુરુ-ઈચ્છાને ગુરુઓંબાં માની લઈને, ગુરુસંદેશને તન-મન-ધ્યાન અને વિચાર-વાણી-વર્તનથી અમલી બનાવીને ‘લધુ’ કેવી રીતે, કેટલી શીધતાથી ‘ગુરુ’ બની જાય છે, તેનું તેઓ પોતા દારા પ્રત્યક્ષ પ્રમાણ રજૂ કરશે.

“એમના ભાથી ઈન્દ્રાદિની વાત થઈ. હવે રક્ષાની વાત. નેમ અલિમન્યુની રક્ષા કુંતામાતાની રાખી કરતી હતી તેમ ગુરુશ્રદ્ધાની રાખી એમની રક્ષા કરશે. ગુરુશ્રદ્ધા એટલે ગુરુદેવ તરફની અટલ, અચલ, અંબંડ શ્રદ્ધા. ગુરુશ્રદ્ધાની દાનારીમાં ઘણાંડની તમામ શ્રદ્ધાઓ લધુમાં પરિણમી જાય. ગુરુશ્રદ્ધા તેને ધારાગુણ કરનારને ગુરુ બનાવી હે. ગુરુશ્રદ્ધા એને ધારાગુણ કરનારના સંપર્કમાં આવનારને ગુરુ બનાવી હે. આવી ગુરુશ્રદ્ધા હશે એમની રાખી. કોઈ સ્થૂળ દીક્ષાની રક્ષા નહીં, પરંતુ ગુરુશ્રદ્ધાની અતિ સૂક્ષ્મ રક્ષા. લધુ, ગુરુ સાથે તાદાન્ય સાખીને ગુરુ બની જાય છે. ગુરુ સાથે એકાકાર થઈ ગયા પછી ગુરુવિષોળ અસહનીય છે. એ અવસ્થામાં, સ્ત્રાર્થ માટે શરીર પોકારી જોઈ છે કે ‘અબ તુમ્હારે હવાલે ગુરુદેવ, સાથીઓ!’ તો, એ વખતે ગુરુજ્ઞાન એમની વહારે ખાશે કે પરમશાનથી તો હું ગુરુદેવની સાથે જ છું અને ગુરુદેવ મારી સાથે જ છે.

“આપણા ભરતભાઈ (દાલમાં અમેરિકા છે તે) કહેતા હતા કે યોગભિકૃતું એ વિનુભાઈને ‘બાપુ’ ની પદવી આપો. ત્યારે

અમે ખુલાસો કર્યો કે તમે કહો છો એમ નથી. પરંતુ વિનુભાઈ અમારા સંપર્કમાં આવ્યા તે પહેલાં જ બાપુનું ઉપનામ પામી ચૂક્યા હતા. એથી વિનુભાઈને 'બાપુ' નનાવવાનો પણ-અપયશ અમને મળે એ બાબાર ન કહેવાય. બાપુનો એ પોતાની મહેનતથી ધર્દી ગયેલા જ હતા. એમનું મેળા એમને બાપુ જ કહેતું હતું. તો, એમાં તો એમની પોતાની સાથના હતી. એમાં અમને કોઈ એમ કહેકે યોગભિન્નું એ એમને બાપુની પદવી આપી, તો એ તો અમને મફતમાં પણ મળી ગયો કહેવાય. એ હીક ન કહેવાય. અને એને અપયશ યાગીએ તો એ અપયશ પણ અમે કેવા માગતા નથી.

"અમારા સંપર્કમાં આવવાથી કે અમારા સંપર્કમાં આવ્યા પણી તેઓ ભિન્નું નની જાય હશે કે ભિન્નું બની નશે એવી સંભાવના ખરી. અમારા તરફથી એટલે કે તમારા તરફથી એમને કોઈ ઉપનામ મળે એવું તમે સો ઈચ્છતા હો અને તમને સોને જમતું હોય અને એમાં એમને વાંચો ન હોય તો એમને વાતસલ્યથી ભરપૂર એવું એક ઉપનામ બોટ-પ્રસાદીદ્વારે આપીએ. (એ વખતે સભામાંથી વિનુભાઈ બોલા કે બધું જ આપી દી.) આપણે એમને ઉપનામ આપીએ એનો અર્થ એવો નથી કે એમને સંન્યાસી બનાવી દેવાના છે, કે એમને દીક્ષા આપવાની છે, કે એમને બધાં વસ્તુ પહેલાવવાનાં છે, કે એમને આપણાથી 'જુદા' કરવાના છે. આ તો, એમ આપણા ઘરે નાનું બાળક હોય એને કોઈ ભોપલો કહે છે, કોઈ બાળલો કહે છે; એમ વાતસલ્યથી ભરપૂર નામ હોય છે ને? એવું નામ, ઓમ્પરિવારનું આપેવું નામ. અને એનાથી અમૃત અર્થનું બોધન થતું હોય, અમૃત અર્થ વચ્ચ થતો હોય એવું નામ, એમના સ્વભાવવે, ગુરુને અનુરૂપ નામ, જે અમને ગમ્યું છે - "ગુરુપ્રેમભિન્નું".

"ગુરુપ્રેમભિન્નુંનો અર્થ શું? ગુરુપ્રેમ એટલે ગુરુદેવનો પ્રેમ, ધારો ભારે પ્રેમ, બહુમૂલ્ય પ્રેમ, ગુરુદેવનો એમના તરફનો પ્રેમ, એમનો ગુરુદેવના તરફનો પ્રેમ. ભિન્નું એટલે સાચી સમજણું પ્રાપ્ત કરવો; તે જ એમનો સંન્યાસ, ત્યાજ. એથી ગુરુપ્રેમભિન્નું એટલે એને ગુરુદેવનો પ્રેમ પ્રાપ્ત કરવામાં વચ્ચે જે નિરતર આવ્યું એને એક લાતે ઉડાડી દીધું, એવા શરવીર પુરુષ. ગુરુપ્રેમભિન્નું એટલે એને ગુરુદેવને પ્રેમ આપવામાં વચ્ચે જે કંઈ બધનો આવાં એને એક જાટકે કાપી નાખ્યાં, ત્યાગી દીધ્યાં, એવા મહા વીર પુરુષ. આવો છે ગુરુપ્રેમભિન્નુંનો અર્થ, ધારો જ વિશાળ અર્થ છે.

"ગુરુપ્રેમભિન્નું તો હવે અમેરિકા જઈ રહ્યા છે. અમે

અમને અમેરિકા જવાની સંમતિ આપી જ ન હોત, જે પરમાત્માએ ડોક્ટર સોમાભાઈ પટેલને મોકલ્યા ન હોત, ડોક્ટરની બેટ અમને મળી ન હોત તો ગુરુપ્રેમભિન્નું અમેરિકા જવાની સંમતિ આપી જ ન હોત. ગુરુપ્રેમભિન્નું અમેરિકા જાય પછી આપણી પાસે કશું રહે નથી. એમના પોતાની બદલીમાં આપણું તેઓ ડોક્ટરને આપતા જાય છે. અને તમારી ઈચ્છા એમને પણ વાતસલ્યથી ભરપૂર નામ આપવાની હોય તો તેમને પણ નામ આપીએ. એથી વિનુભાઈના પ્રતિનિધિ તરફાં એમની જવાબદારીઓ સંભાળે. તો, હવે એમને પણ પૂછવું જોઈએ ને? એમની સંમતિ તો બેબી પણ ને? જે સોમાભાઈની ઈચ્છા હોય તો આપણે એક નામ આપીએ. (સોમાભાઈ મૌન છે. નીચું જોઈને બેઠા છે.) મૌનમું સંમતિ લક્ષાણુમ! તો એમનું ખુલામાંનું નામ તેમના ગુરુના-સ્વભાવ પ્રમાણે "સદગુરુસમપાશગુરુભિન્નું". હાલમાં તો આ કાગળનો સિક્કો આપીએ છીએ, પછી એમને પાકો બનાવીને આપીશું. તો, સોમાભાઈને આ વાતસલ્યભરપૂર નામ આપણું કરે છે આપણા ગુરુપ્રેમભિન્નું." (એ વખતે ચો આનંદમાં આવીને બોલે છે - સત્યગુરુદેવની જાય, ધર્મગુરુદેવની જાય.)

## પૂ. રવુભા બાપુનાં આશીર્વયન

રામચંદ્ર ભગવાનની જાય, કૃષ્ણભગવદેવની જાય.

પૂ. ગોળીશાલશ્રી (યોગભિન્નું) તથા ઓમ્પરિવાર.

આજે આપણે શ્રી વિનુભાઈને શુભેચ્છા આપવા ભેગા થયા છીએ. ગુરુમહિમા એ અમૃત્ય છે. એનો કોઈ કિમત કરી શકે તેમ નથી. રામાયણમાં લખ્યું છે - ગુરુ બિન હોય ન જ્ઞાન, જ્ઞાન ન હોય વેરાય જિન. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી એમ તુલસીદાશજી લખે છે. પરંતુ જ્ઞાન ઉપર પ્રેમ ન હોય તો ગુરુ જે તેટલું જ્ઞાન આપે તોપણ એ જ્ઞાન દરી શકતું નથી, શિષ્ય તે લઈ શકતો નથી. એને માટે લખ્યું છે કે પથ્યર ઉપર અમૃતની વૃષ્ટિ થાય તોપણ એના ઉપર દૂલ્હ ઊગતાં નથી. જેવી રીતે મનુષ્યને જ્ઞાન લેવાની ઈચ્છા ન થાય ત્યાં સુધી બ્રહ્મા નેવા સો ગુરુઓ એની આનુભાજુ આવે તોપણ એને જ્ઞાન લાપું નથી. જ્ઞારે સમર્થ શિષ્ય મળે અને સમર્થ ગુરુ મળે તારે જ શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે.

આપણે જાગીએ છીએ કે સ્વાતિના વરસાદ સિવાય સાચાં મોતી પાકતાં નથી. સ્વાતિ તો બપે વરે છે, પણ જે છીપ એ સ્વાતિનું જળ જીવે છે એમાં જ મોતી થાય છે, બીજી છીપમાં

थतां नथी. अम गुरुवामने लेणे ग्रहण कर्यु छे ए व साथू मोती थई शके. अने अना माटे विनुभाईने पन्यवाद आपीओ छाइ. हुं तो अमने कहुं छुं के ओमपरिवार अटबे ओमकार छे. ओम ए ईश्वरनुं नाम छे. अमां रेफ थाय छे, ए अनी भुज छे, ए अनो मकार छे. तो, हुं तो रामलक्ष्म छुं अटबे भगवानने प्रार्थना कहुं छुं के ओमकार छे ए पाणि तमाहुं स्वरूप छे. अटबे न्यारे विनुभाईने सद्बायतानी जड़त पडे त्यारे अमने सद्बायता पहोचाउने अली अमारी सर्वनी प्रार्थना छे. हरि ओम.

## गुरुप्रेमभिक्षुल्लनुं उद्भोधन

प्रातःस्मरणीय प. पू. गुरुदेव श्री योगभिक्षुल्ल  
भक्तशिरोमणी रुद्रभा बापु, मोटाभाई (श्री गीरजाशंकर जेशी)  
अने ओमपरिवारना हित्य आत्माओ.

धारा वाखत पढी बोलवानो प्रसंग थयो छे. आम तो धरमां, जाननीमां सन्तंगो चाल्या करे. अहेरमां बोलवानो प्रसंग पहेला वार उल्लो थयो छे.

आपाणे कहीओ छाइ के प्रातःस्मरणीय गुरुदेव, तो शुं गुरुने सपारे ज्याद करवाना, बधोरे के राने नहीं? हुं तो कहुं छुं के निरंतर स्मरण चालवुं ऐझीओ. अटबा बधा गुरुमय थई जाव. ज्वननी हर जागे, शासोचास स्मरण चालवुं ऐझीओ. आ वातनी मने सतत अनुभव छे. गुरुमहाराज पासेथी कोई मोटामां मोटी लेट मणी दोय तो तो छे 'सद्गुरुओ जोवानीटेव'. दुनियामां कोईपाणि, जट के चेतन, सारो के भराब कोईपाणि, गुणग्राहक दण्डने लीपि हुश्मन नथी लागतो. आ वस्तु ओमपरिवारमां ग्राह जनवी जोझीओ, स्वीकारवी ऐझीओ. तो तमारा ज्वनमां कदापि निष्ठिना नहीं आवे. तमे साचा माणसने छेतरता नहीं, परंतु समझने छेतरावानो प्रयत्न करने; तो तमे कोई जग्याने छेतराशी नहीं. गुरुल्ल पासेथी आ आशुभोल लेट मने मणी छे. अटबे हुं कोई वाखत निराश थयो नथी, थतो नथी.

मारा मोटाभाई अमेरिका छे. ए अमना ज्वनमां धार्यां वार निराश थाय त्यारे मारी पासे आवे. माणस मरी ययो दोय तो जीञ भिनिटे बोल्शे अटबी बधी मने आशाओ. अटबे धार्यां वार मने कहे, "विनु, तारा जेटबो उन्साली अने आशावाई माणस जेयो नथी!" कुटुंबनी भराबमां भराब लालतमां हुं अेकबो उस्तो लीउ. अने झारागे अमे बधा भाईओ अमेरिकामां छीओ. मारो विचार धार्यां वर्ष पहेलां अमेरिका

ज्वानो छतो. धार्यां संजेगो अवा नने अने परिस्थितिवश लंबाय अटबे न्यारे ज्वारे आवा प्रसंगो थाय छे अने लेम लेम गुरुल्लना सांनिध्यमां आववानुं थतुं जयु अम श्रद्धा वधु लियर थती गई.

गुरुल्लना सांनिध्यमां आववाना मारा श्रद्धातना प्रसंगो नुं वार्षिन कहुं तो तमने अम लागे के 'आपाणे भरेखर नसीबदार छाइओ.' देवोने हुबल अेतु नसीब आपाणी साथे छे. घरेथी नीकितां पहेलां ज शरीरमां धरतीकंप चालु थई थाय. गुरुल्लनी साथे बोलवानुं तो बानुओ रह्यु परंतु गुरुल्ल केवी रीते लेशे आपाणी सामे, ए अगत्यानुं थई पहल्तु. अमारे माटे परीक्षा हती. ज्योतिपी तरीके लोको मने ओणापे. वास्तवमां हुं ज्योतिप जागतो नथी. परंतु लोको अम माने के हुं बोलु ए जयु पडे छे. ज्युं तो तमे पाडो छो. कारणके तमारा ज्वनमां ले संजेगो छि, ए संजेगो बदली नाओ अटबे सङ्खिता तमारी ज छे; परंतु अमां नम्रता, निरहंकारीपाणु लेवा सद्गुरुओ आपाणी पासे दोवा जोझीओ. तेवा सद्गुरुओ सद्गुरु पासेथी प्राप्त थाय छे.

सद्गुरु आपाणुने मध्या छे अने अमनी चराणरन वेवानुं सद्भाव्य आपाणुने प्राप्त थयुं छे. युगो सुधी अमनी साथे रहीओ, जन्मजन्मांतर सुधी अमनी साथे रहीओ. अने सद्गुरुने शुं आपी शजीओ? हुं तो अम मानुं छुं के आपाणा बधा जन्मोना सत्कर्मने, पुण्यने अने जे कांઈ पुण्य-कर्म हवे करवानां, ते नष्टु मूँकी दहीओ तोपाणि आपाणुं पव्वुं हव्वुं ज रहेवानुं, आपाणुं पव्वुं नमवानुं नथी. सद्गुरुनो अकेक शब्द ज्वनमां आदर्श तरीके उतारीशुं, तो पछी कहो के आपाणे संसारमां हुः ख प्राप्तीकीरीशुं? जे कांઈ सुख छे ते प्राप्त करवानी चावीओ. त्यां ज छे. अने अनी न्यारे समजाण आवशे - हुं तो न्यारे गुरुल्ल पासे आवो त्यार पछी हुः ख शुं छे अनी जाग मारा माटे तो मुक्तेव छे, कारणके मननी अटबी बधी अकाश्वता, सहनशक्ति गुरुल्लना सांनिध्यमात्रयी प्राप्त थई छे. हुं जे कुर्ह छुं ए मारा गुरुल्लना प्रतापयी छुं. अस्तु.

तो, ता. १४-२-८० ना रोज महाशिवरात्रीना हिवसे ओमपरिवारना जे सत्संगीओनी विष्णुथई. श्री विनुभाई शाल बन्या गुरुप्रेमभिक्षु अने डो. सो मोटाभाई पटेल जन्मा सद्गुरुसमर्पणभिक्षु. ता. ३-५-८० ना रोज श्री रोहीतभाई सुभित्यानुं नामकरण थयुं, लेमने गुरुध्यानभिक्षु नाम आपाणु. श्री गुरुध्यानभिक्षुल्लना नामकरण हिवसनी विजतो हवे पछीना अंकमां प्रगट करीशुं.

## ઓ. પ્રે. પ. ટ્રોસ્ટને માધ્યમ બનાવી પ્રોફેક્ટ-લાયબ્રેરી અંતર્ગત પુસ્તકાલયોને સ્પોન્સર કરનારાઓની યાદી

ક્રમાંક	નામ	પુસ્તકાલયોની સંખ્યા	ક્રમાંક	નામ	પુસ્તકાલયોની સંખ્યા
૧)	સ્વ. શ્રી કેશવલાલ વ્યાસ	૧૬	૧૦)	શ્રી પી. જેન. રાહોડ	૧
૨)	મે. શ્રીજી તેવલપર્સ	૧૦	૧૧)	શ્રી કે. એમ. કાપડીયા	૧
૩)	શ્રી મોહનદાસ ગોરથનદાસ ભાવસાર	૫	૧૨)	શ્રી આર. સી. પાઠક	૧
૪)	શ્રી ગોનસભાઈ અને મિત્રો	૫	૧૩)	શ્રી એ. એમ. પઠાન	૧
૫)	શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ	૪	૧૪)	શ્રી સી. વી. પરમાર	૧
૬)	શ્રી એન. એસ. ગાંધી	૪	૧૫)	મે. સંનાય સોની એન્ડ એસોસીએટ્સ	૧
૭)	શ્રી હિરાભાઈ દેવુભાઈ રબારી	૪	૧૬)	શ્રી સ્વયંસિદ્ધા આર. પંજ્યા	૧
૮)	મે. કે. કે. ટી. રીપો	૨	૧૭)	શ્રી ભાર્ગવ આર. પંજ્યા	૧
૯)	શ્રી માનજીભાઈ થોભાળભાઈ પટેલ	૨	૧૮)	શ્રી પલ્લવી આર. પંજ્યા	૧

## પ્રોફેક્ટ-લાયબ્રેરી હેઠળ આવરી લેવાયેલ પુસ્તકાલયોની યાદી (ગતાંકથી ચાલુ)

૧૮૭૧	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. આણીપોર, તા. ભાગડ, નિ. સાખરકાંઠા.	૧૮૭૮	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. ચીંઘાણી, તા. સંતરામપુર, નિ. પંચમલાલ.	૧૮૮૫	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. વાંગડ,
૧૮૭૨	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. અસોકપુરા, તા. દિંમતનગર, નિ. સાખરકાંઠા.	૧૮૭૯	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. બોરીઆ, તા. સંતરામપુર, નિ. પંચમલાલ.	૧૮૮૬	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. મધ્યપુર,
૧૮૭૩	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. રાવોલ, તા. ઈરાર નિ. સાખરકાંઠા.	૧૮૮૦	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. ચીંઘાણી, તા. સંતરામપુર, નિ. પંચમલાલ.	૧૮૮૭	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. બડારા,
૧૮૭૪	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. કમાલપુર, તા. પ્રાંતીજ, નિ. સાખરકાંઠા.	૧૮૮૧	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. આસપુરા, તા. સંતરામપુર, નિ. પંચમલાલ.	૧૮૮૮	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. છોતરા,
૧૮૭૫	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. શામળાણ, તા. બિલોડા, નિ. સાખરકાંઠા.	૧૮૮૨	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. વાંકાનેર, તા. સંતરામપુર, નિ. પંચમલાલ.	૧૮૮૯	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. સરાડ,
૧૮૭૬	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. રાયપુર, તા. બિલોડા, નિ. સાખરકાંઠા.	૧૮૮૩	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. પાઠ્લીયા, તા. સંતરામપુર, નિ. પંચમલાલ.	૧૮૯૦	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. સરસી,
૧૮૭૭	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. કેશવપુરા, તા. બિલોડા, નિ. સાખરકાંઠા.	૧૮૮૪	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. મોલારા, તા. સંતરામપુર, નિ. પંચમલાલ.	૧૮૯૧	સાર્વનિક પુસ્તકાલય મુ. પો. પડારીઆ,
જાન્યુઆરી - ૧૯૮૮					તા. સંતરામપુર, નિ. પંચમલાલ.

१८८२	सार्वजनिक पुस्तकालय मु. पो. श्रापाणा, ता. संतरामपुर, जि. पंचमहाल.	१८८४	सार्वजनिक पुस्तकालय मु. पो. धनेश्वर, ता. देवगढबारिया,	मु. पो. सांपोई, ता. जालोद, जि. पंचमहाल.	
१८८३	सार्वजनिक पुस्तकालय मु. पो. टीभरवा, ता. संतरामपुर, जि. पंचमहाल.	१८८५	सार्वजनिक पुस्तकालय मु. पो. बोनपुरा,	१८९७	सार्वजनिक पुस्तकालय मु. पो. वांडोल, ता. जालोद, जि. पंचमहाल.
१८८४	सार्वजनिक पुस्तकालय मु. पो. गामी, ता. संतरामपुर, जि. पंचमहाल.	१८८६	सार्वजनिक पुस्तकालय मु. पो. गोलाणा, ता. देवगढबारिया,	१८९८	सार्वजनिक पुस्तकालय मु. पो. वेरका, ता. जालोद, जि. पंचमहाल.
१८८५	सार्वजनिक पुस्तकालय मु. पो. डोसंबा, ता. संतरामपुर, जि. पंचमहाल.	१८८७	सार्वजनिक पुस्तकालय मु. पो. पंचोला, ता. देवगढबारिया,	१८९९	सार्वजनिक पुस्तकालय मु. पो. गोलाणा, ता. जालोद, जि. पंचमहाल.
१८८६	सार्वजनिक पुस्तकालय मु. पो. सबरा, ता. संतरामपुर, जि. पंचमहाल.	१८८९	सार्वजनिक पुस्तकालय मु. पो. धानपुर,	१९२०	सार्वजनिक पुस्तकालय मु. पो. उंगरा, ता. जालोद, जि. पंचमहाल.
१८८७	सार्वजनिक पुस्तकालय मु. पो. उरमेल, ता. संतरामपुर, जि. पंचमहाल.	१८९०	सार्वजनिक पुस्तकालय मु. पो. क्षोई,	१९२१	सार्वजनिक पुस्तकालय मु. पो. चाणासर, ता. जालोद, जि. पंचमहाल.
१८८८	सार्वजनिक पुस्तकालय मु. पो. गोराडिया, ता. संतरामपुर, जि. पंचमहाल.	१८९१	सार्वजनिक पुस्तकालय मु. पो. धावी,	१९२२	सार्वजनिक पुस्तकालय मु. पो. भरमा,
१८८९	सार्वजनिक पुस्तकालय मु. पो. भोगांदरा, ता. संतरामपुर, जि. पंचमहाल.	१८९२	सार्वजनिक पुस्तकालय मु. पो. संगोवी, ता. जालोद, जि. पंचमहाल.	१९२३	सार्वजनिक पुस्तकालय मु. पो. लुणावाडा, जि. पंचमहाल.
१८९०	सार्वजनिक पुस्तकालय मु. पो. इवा, ता. देवगढबारिया, जि. पंचमहाल.	१८९३	सार्वजनिक पुस्तकालय मु. पो. बाजरवाडा,	१९२४	सार्वजनिक पुस्तकालय मु. पो. गांगटा,
१८९१	सार्वजनिक पुस्तकालय मु. पो. खोटा, ता. देवगढबारिया, जि. पंचमहाल.	१८९४	सार्वजनिक पुस्तकालय मु. पो. आलोद, जि. पंचमहाल.	१९२५	सार्वजनिक पुस्तकालय मु. पो. बामरोडा,
१८९२	सार्वजनिक पुस्तकालय मु. पो. जंबुसर, ता. देवगढबारिया, जि. पंचमहाल.	१८९५	सार्वजनिक पुस्तकालय मु. पो. गराड, ता. जालोद, जि. पंचमहाल.	१९२६	सार्वजनिक पुस्तकालय मु. पो. मोरोई,
१८९३	सार्वजनिक पुस्तकालय मु. पो. वाव (जाल), ता. देवगढबारिया, जि. पंचमहाल.	१८९६	सार्वजनिक पुस्तकालय मु. पो. श्रीटा, ता. जालोद, जि. पंचमहाल.	१९२७	सार्वजनिक पुस्तकालय मु. पो. इतेपुरा,
जन्मुआरी- १८८८					१९२८
ता. लुणावाडा, जि. पंचमहाल.					१९२९
श्री नरेंद्रा विजय सार्व. पुस्तकालय					१९३०
मु. सुवा, पो. रहिआद,					


१८३०	ता. वागरा, निर. भट्टच.	१८४३	निर. पंचमहाल.	१८५६	निर. पंचमहाल.
	सार्वजनिक पुस्तकालय		सार्वजनिक पुस्तकालय		सार्वजनिक पुस्तकालय
	मु. पो. वांडीडा,		मु. पो. चापरा, ता. छालोल,		मु. पो. रत्नपुर, ता. गोधरा,
१८३१	ता. लुग्नावाडा, निर. पंचमहाल.	१८४४	निर. पंचमहाल.	१८५७	निर. पंचमहाल.
	सार्वजनिक पुस्तकालय		सार्वजनिक पुस्तकालय		सार्वजनिक पुस्तकालय
	मु. पो. झारा, ता. लुग्नावाडा,		मु. पो. हींडवा, ता. छालोल,		मु. पो. लालपुर,
१८३२	निर. पंचमहाल.	१८४५	निर. पंचमहाल.	१८५८	ना. गोधरा, निर. पंचमहाल.
	सार्वजनिक पुस्तकालय		सार्वजनिक पुस्तकालय		सार्वजनिक पुस्तकालय
	मु. पो. बामाशुवाडा,		मु. पो. चित्रभूपुरा,		मु. पो. कुण्डिल्या, ता. गोधरा,
	ता. लुग्नावाडा, निर. पंचमहाल.		ता. छालोल, निर. पंचमहाल.		निर. पंचमहाल.
१८३३	सार्वजनिक पुस्तकालय	१८४६	सार्वजनिक पुस्तकालय	१८५९	सार्वजनिक पुस्तकालय
	मु. पो. हड्डमतीशा,		मु. पो. त्रितापुरा,		मु. पो. अट्टवा, ता. गोधरा,
	ता. लुग्नावाडा, निर. पंचमहाल.		ता. छालोल, निर. पंचमहाल.		निर. पंचमहाल.
१८३४	सार्वजनिक पुस्तकालय	१८४७	सार्वजनिक पुस्तकालय	१८६०	सार्वजनिक पुस्तकालय
	मु. पो. खोडारांभा,		मु. पो. जोविंदपुरा,		मु. पो. लांडोला, ता. गोधरा,
	ता. लुग्नावाडा, निर. पंचमहाल.		ता. छालोल, निर. पंचमहाल.		निर. पंचमहाल.
१८३५	सार्वजनिक पुस्तकालय	१८४८	सार्वजनिक पुस्तकालय	१८६१	सार्वजनिक पुस्तकालय
	मु. पो. भवाल, ता. कालोल,		मु. पो. धरोवा, ता. शहेरा,		मु. पो. बीजपुर, ता. शहेरा,
	निर. पंचमहाल.		निर. पंचमहाल.		निर. पंचमहाल.
१८३६	सार्वजनिक पुस्तकालय	१८४९	सार्वजनिक पुस्तकालय	१८६२	सार्वजनिक पुस्तकालय
	मु. पो. चवाली, ता. कालोल,		मु. पो. धराली, ता. शहेरा,		मु. पो. अंबाली, ता. शहेरा,
	निर. पंचमहाल.		निर. पंचमहाल.		निर. पंचमहाल.
१८३७	सार्वजनिक पुस्तकालय	१८५०	सार्वजनिक पुस्तकालय	१८६३	सार्वजनिक पुस्तकालय
	मु. पो. झानोड़, ता. कालोल,		मु. पो. धर्माई, ता. शहेरा,		मु. पो. उमरपुर, ता. शहेरा,
	निर. पंचमहाल.		निर. पंचमहाल.		निर. पंचमहाल.
१८३८	सार्वजनिक पुस्तकालय	१८५१	सार्वजनिक पुस्तकालय	१८६४	सार्वजनिक पुस्तकालय
	मु. पो. भोड़ण, ता. कालोल,		मु. पो. साठरा, ता. शहेरा,		मु. पो. नवापुरा,
	निर. पंचमहाल.		निर. पंचमहाल.		ता. निर. वडोदरा.
१८३९	सार्वजनिक पुस्तकालय	१८५२	सार्वजनिक पुस्तकालय	१८६५	सार्वजनिक पुस्तकालय
	मु. पो. नाराणपुरा,		मु. पो. भरोवी, ता. शहेरा,		मु. पो. टेण्णा,
	ता. कालोल, निर. पंचमहाल.		निर. पंचमहाल.		ता. निर. वडोदरा.
१८४०	सार्वजनिक पुस्तकालय	१८५३	सार्वजनिक पुस्तकालय	१८६६	सार्वजनिक पुस्तकालय
	मु. पो. अंबलीयारा,		मु. पो. छिरापुर, ता. शहेरा,		मु. पो. सीसवा,
	ता. कालोल, निर. पंचमहाल.		निर. पंचमहाल.		ता. निर. वडोदरा.
१८४१	सार्वजनिक पुस्तकालय	१८५४	सार्वजनिक पुस्तकालय	१८६७	सार्वजनिक पुस्तकालय
	मु. पो. पावागढ़, ता. कालोल,		मु. पो. वाडीया, ता. शहेरा,		मु. पो. आजेड़,
	निर. पंचमहाल.		निर. पंचमहाल.		ता. निर. वडोदरा.
१८४२	सार्वजनिक पुस्तकालय	१८५५	सार्वजनिक पुस्तकालय	१८६८	सार्वजनिक पुस्तकालय
	मु. पो. पंडण, ता. कालोल,		मु. पो. रामपुरा, ता. गोधरा,		मु. पो. दोड्डा,

१८७८	ता. निर. वडोदरा.	१८८२	सार्वजनिक पुस्तकालय	१८८६	सार्वजनिक पुस्तकालय
	मु. पो. घराणी,		मु. पो. नर्सांधपुरा,		मु. पो. सीमणी, ता. करनाग,
	ता. निर. वडोदरा.		ता. वाधोडीया, निर. वडोदरा.		निर. वडोदरा.
१८७९	सार्वजनिक पुस्तकालय	१८८३	सार्वजनिक पुस्तकालय	१८८७	सार्वजनिक पुस्तकालय
	मु. पो. मारेठा,		मु. पो. तरसवा,		मु. पो. बडापुर, ता. करनाग,
	ता. निर. वडोदरा.		ता. वाधोडीया, निर. वडोदरा.		निर. वडोदरा.
१८८०	सार्वजनिक पुस्तकालय	१८८४	सार्वजनिक पुस्तकालय	१८८१	प्रेसिडेन्ट ने. बी. खीटीट
	मु. पो. मारेठा,		मु. पो. अंबाली,		सार्वजनिक पुस्तकालय
	ता. निर. वडोदरा.		ता. वाधोडीया, निर. वडोदरा.		मु. पो. जिलीमोरा,
१८८१	सार्वजनिक पुस्तकालय	१८८५	सार्वजनिक पुस्तकालय	१८८२	निर. वलसाड (गुलजार).
	मु. पो. घोर,		मु. पो. कुमेडा,		सार्वजनिक पुस्तकालय
	ता. निर. वडोदरा.		ता. वाधोडीया, निर. वडोदरा.		मु. पो. टेथाण, ता. करनाग,
१८८२	सार्वजनिक पुस्तकालय	१८८६	सार्वजनिक पुस्तकालय	१८८३	निर. वडोदरा.
	मु. पो. वरसोडा,		मु. पो. गांगेशपुरा,		सार्वजनिक पुस्तकालय
	ता. निर. वडोदरा.		ता. वाधोडीया, निर. वडोदरा.		मु. पो. लांडोदरा, ता. करनाग,
१८८३	सार्वजनिक पुस्तकालय	१८८७	सार्वजनिक पुस्तकालय	१८८४	निर. वडोदरा.
	मु. पो. वडवाला,		मु. पो. वेसापुरीया,		सार्वजनिक पुस्तकालय
	ता. निर. वडोदरा.		ता. वाधोडीया, निर. वडोदरा.		मु. पो. महेली,
१८८४	सार्वजनिक पुस्तकालय	१८८८	सार्वजनिक पुस्तकालय	२०००	ता. वाधोडीया,
	मु. पो. कलापुर,		मु. पो. साकरीया,		निर. वडोदरा.
	ता. निर. वडोदरा.		ता. वाधोडीया, निर. वडोदरा.		सार्वजनिक पुस्तकालय
१८८५	सार्वजनिक पुस्तकालय	१८८९	सार्वजनिक पुस्तकालय	२००१	मु. पो. चालासद,
	मु. पो. राधवपुरा,		मु. पो. भूमसिया,		ता. पादरा, निर. वडोदरा.
	ता. निर. वडोदरा.		ता. वाधोडीया, निर. वडोदरा.		सार्वजनिक पुस्तकालय
१८८६	सार्वजनिक पुस्तकालय	१८९०	सार्वजनिक पुस्तकालय	२००२	मु. पो. गोरीपाई,
	मु. पो. तवसर,		मु. पो. चियांगाम,		ता. पादरा, निर. वडोदरा.
	ता. निर. वडोदरा.		ता. करनाग, निर. वडोदरा.		सार्वजनिक पुस्तकालय
१८८७	सार्वजनिक पुस्तकालय	१८९१	सार्वजनिक पुस्तकालय	२००३	मु. पो. भावुवड, ता. पादरा,
	मु. पो. अटेला,		मु. पो. कुडारी, ता. करनाग,		निर. वडोदरा.
	ता. निर. वडोदरा.		निर. वडोदरा.		सार्वजनिक पुस्तकालय
१८८८	सार्वजनिक पुस्तकालय	१८९२	सार्वजनिक पुस्तकालय	२००४	मु. पो. सरसवाणी,
	मु. पो. उडेरा,		मु. पो. मांगरोल, ता. करनाग,		ता. पादरा, निर. वडोदरा.
	ता. निर. वडोदरा.		निर. वडोदरा.		सार्वजनिक पुस्तकालय
१८८९	सार्वजनिक पुस्तकालय	१८९३	सार्वजनिक पुस्तकालय	२००५	मु. पो. अंबाडा, ता. पादरा,
	मु. पो. ऐरावडी,		मु. पो. भूलभास, ता. करनाग,		निर. वडोदरा.
	ता. वाधोडीया, निर. वडोदरा.		निर. वडोदरा.		सार्वजनिक पुस्तकालय
१८९०	सार्वजनिक पुस्तकालय	१८९४	सार्वजनिक पुस्तकालय	२००६	मु. पो. साईरा, ता. पादरा,
	मु. पो. अंटेला,		मु. पो. भेडा, ता. करनाग,		निर. वडोदरा.
	ता. वाधोडीया, निर. वडोदरा.		निर. वडोदरा.		सार्वजनिक पुस्तकालय
१८९१	सार्वजनिक पुस्तकालय	१८९५	सार्वजनिक पुस्तकालय	२००७	मु. पो. आमोदरा,
	मु. पो. आमोदरा,		मु. पो. भेडा, ता. करनाग,		ता. पादरा, निर. वडोदरा.
	ता. वाधोडीया, निर. वडोदरा.		निर. वडोदरा.		सार्वजनिक पुस्तकालय

2008	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. શહેરા, તા. પાદરા, નિ. વડોદરા.	2029	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. કરસીયા, તા. સાપલી, નિ. વડોદરા.	2038	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. ચન્વાડા, તા. ઇલોઈ, નિ. વડોદરા.
2009	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. કોટાણા, તા. પાદરા, નિ. વડોદરા.	2022	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. અંકલિયા, તા. સાપલી, નિ. વડોદરા.	2039	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. બોરીયાદ, તા. ઇલોઈ, નિ. વડોદરા.
2010	નિ. વડોદરા. સંકારી માધ્યમિક શાળા મુ. પો. આદવા-ઠાંગ, પીન-૩૫૪૭૭૧૦.	2023	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. મુઢેલા, તા. સાપલી, નિ. વડોદરા.	2039	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. હાંપુરા, તા. સાપલી, નિ. વડોદરા.
2011	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. પન્નોજ, તા. સાપલી, નિ. વડોદરા.	2024	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. ચંગનગર, તા. સાપલી, નિ. વડોદરા.	2039	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. વાબીપુરા, તા. ઇલોઈ, નિ. વડોદરા.
2012	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. વિરોજ, તા. સાપલી, નિ. વડોદરા.	2026	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. મેવલી, તા. સાપલી, નિ. વડોદરા.	2038	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. નંદેરિયા, તા. ઇલોઈ, નિ. વડોદરા.
2013	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. મેવલી, તા. સાપલી, નિ. વડોદરા.	2027	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. કડા, તા. સાપલી, નિ. વડોદરા.	2040	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. માવલી, તા. ઇલોઈ, નિ. વડોદરા.
2014	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. પિલોલ, તા. સાપલી, નિ. વડોદરા.	2028	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. કુંદેલા, તા. ઇલોઈ, નિ. વડોદરા.	2041	નિ. વડોદરા. ગાપત્રી પુસ્તકાલય મુ. પો. લીમડી, તા. જાલોદ, વાયા. દાલોદ, નિ. પંચમહાલ, પીન-૩૮૯૧૮૦.
2015	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. વકતાપુરા, તા. સાપલી, નિ. વડોદરા.	2029	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. કુંદેલા, તા. ઇલોઈ, નિ. વડોદરા.	2042	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. માલપુર, તા. ઇલોઈ, નિ. વડોદરા.
2016	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. વકતાપુરા, તા. સાપલી, નિ. વડોદરા.	2030	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. કોલાર, તા. ઇલોઈ, નિ. વડોદરા.	2043	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. ગરાડા, તા. ઇલોઈ, નિ. વડોદરા.
2017	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. વેનપુર, તા. સાપલી, નિ. વડોદરા.	2031	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. મુનીપાટ, તા. ઇલોઈ, નિ. વડોદરા.	2044	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. વાણીપાટ, તા. ઇલોઈ, નિ. વડોદરા.
2018	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. વરસડા, તા. સાપલી, નિ. વડોદરા.	2032	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. રાજલી, તા. ઇલોઈ, નિ. વડોદરા.	2045	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. નેખડા, તા. ઇલોઈ, નિ. વડોદરા.
2019	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. ઈટાવાડા, તા. સાપલી, નિ. વડોદરા.	2033	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. મોરપુરા, તા. ઇલોઈ,	2046	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. નેખડા, તા. ઇલોઈ, નિ. વડોદરા.
2020	નિ. વડોદરા. સાર્વલનિક પુસ્તકાલય મુ. પો. પ્રતાપપુરા, તા. સાપલી,				

બેસર ટાઇપોટોટો : - જાનકી ગ્રાહિકસ એન્ડ સ્ટીન પ્રિન્ટીંગ ૧૦, નિવેશી પાર્ક સોસાપટી, રનાપાર્ક, અમદાવાદ-૬૧. ફોન :- ૭૨૫૪૪૪૬૬૮  
અન્નુઆરી-૧૯૯૮

ओं शर का बोधक (नाम) प्रणव/ओम् है।



(समाधिषाद के दूषों का नाशनावाद)

- (२४) क्लेश, कर्म, कर्मफल और वासना जिसमें नहीं है ओमा पुरुषविशेष/चेतनविशेष ओंशर है।
- (२५) ओंशर संपूर्ण सर्वज्ञ है।
- (२६) ओंशर पूर्वकाल के गुरुओं के भी गुरु हैं और काल की मर्यादा से (जन्म-मृत्यु से) पर है।
- (२७) ओंशर का नाम प्रणव/ओम् है।
- (२८) अर्थ के चिन्तन सहित ओम् का जप करना।
- (२९) चिन्तन सहित जप करने से अन्तरायों का अभाव और आत्मसाक्षात्कार होता है।

गणित्यान् ओम् योगिका, १/अ०, विश्वनाथ, नालंगपुरा, अहमदाबाद-३८० ०९२।

### ● द्रष्टव्याएः उद्देशो :-

- (१) सर्वत्यापक पटम् शूक्रम् योतन तत्त्व के जेनुं नाम प्रणव (ओम् -ॐ) छे तेनी प्रतीति बहुजनसमाजने करावावा प्रयत्न करवो। (२) 'योग' नो मर्याद, मर्साद अने संशोधन करवा प्रयत्न करवो। (३) समाजनुं नैतिक धोरण शिंयुं लाववा माटे आध्यात्मिक ज्ञानों साहित्य छारा मर्याद अने मर्साद करवानो प्रयत्न करवो। (४) आ उपरांत 'बहुजनहिताय-बहुजनसुखाय' ने लगतां कार्यों लेवां के केलवणी, तजीजी सारवार वगेटे करवा माटे प्रयत्न करवो।

**PRINTED BOOK**

Registrar of News Papers of India under Regd. No. 48770/90  
L-5/131/QTY/34/90-91

**ાધિકસંસ્થાપક તથા આધ્યાત્મિક વડા**

**પ. પુ. ગુરુદેવ શ્રી યોગભિસુજુ**



**PRINTED & PUBLISHED BY :-**

Dr. S. S. Bhikshu for  
AUMGURU PREMSAMARPANDHYANBHIKSHU PARIVAR TRUST  
1/A, Palladnagar Society, Naranpura, Ahmedabad - 380 013.  
Printed at: Kunai Offset, Odhad, Ahmedabad.  
Hon. Editor : Naishadh vyas  
(Reg. No. E/4416 Date 11-5-81)  
I.T.E.U 80-G (5) No. H.O. -III 33-163/95-96 up to March 2000

**લવાજમ દર :-**

વાર્ષિક સભ્ય (ભારતમાં) ----- રૂ. ૨૦-૦૦  
આજીવન સભ્ય ( " ) ----- રૂ. ૨૫૦-૦૦  
વાર્ષિક સભ્ય (પરદેશમાં) ----- ૧૨ \$  
આજીવન સભ્ય ( " ) ----- ૧૦૧ \$

**લવાજમ મોકલવાનું સ્થળ :-**

- (૧) ડૉ. સોમાલોઈ એ. પટેલ  
૧/અ, પલિયાનગર,  
સેન્ટ ગેવિયર્સ હાઇસ્કુલ રોડ,  
નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૯૩.
- (૨) નૈષદ્ધભાઈ સી. વ્યાસ  
"સ્વાશ્રય",  
૩, ગંગાધર સોસાયટી, રામબાગ પાછળ,  
મહેનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮.

**સૂચના :-**

- (૧) લવાજમ ચેક દ્વારા અથવા મનીઓર્ડ દ્વારા  
"ઓ. પ્રે. પ. ટ્રસ્ટ" ના નામે મોકલવું. સાથે  
આપનું પૂર્ણ નામ, સરનામું શુદ્ધ અકારોમાં  
લખી મોકલવું.
- (૨) જે સભ્યનાં રહેઠાણનાં સ્થળ બદલાયાં હોય  
તેમણે તેમના નવા રહેઠાણનું પૂર્ણ સરનામું  
લખી મોકલવું જેથી વ્યાસ્થાપકોને અંક  
મોકલવામાં સરળતા રહે.
- (૩) "લતમ્ભરા" ને લગતો પત્રવ્યવહાર નીચેના  
સરનામે કરવો.  
નૈષદ્ધભાઈ સી. વ્યાસ  
"સ્વાશ્રય",  
૩, ગંગાધર સોસાયટી, રામબાગ પાછળ,  
મહેનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮.

**પ. પુ. ગુરુદેવ શ્રી યોગભિસુજુ**  
**સાથેના સંસ્મરણો તથા પ્રેરક**  
**પ્રસંગો આવકાર્ય છે.**

To,  
LH-318  
NARENDA R. DAVE  
Pin Code


LH-318  
NARENDA R. DAVE  
Pin Code